

ન્યૂઝ બ્રિફ

પાકિસ્તાનના મીડિયા પર પણ અંકુશ માટે ચીનના પ્રયાસ

। ઈસ્લામાબાદ, તા.પ. । મિત્રતાના નામે પાક.નો ભરડો લેનાર ચીન હવે પાકિસ્તાનના મીડિયાને પણ અંકુશમાં લેવા માટે પ્રયાસો કરી રહ્યું છે તેવો ચીનકાવારો ખુલાસો થયો છે. ચીન પાકિસ્તાન જ નહીં પણ દુનિયાભરમાં મીડિયા પર કંટ્રોલ કરીને પોતાની ઈમેજ ચમકાવવા માટે ધમપછાડા કરી રહ્યું છે અને આ માટે તે ગમે તે હદ સુધી જવા માટે તૈયાર છે. ભારતમાં આવા જ એક મીડિયા સંસ્થાન પર ચીન પાસેથી ફંડિંગ લેવા બદલ કાર્યવાહી થઈ છે. દરમિયાન પાકિસ્તાનમાં ચીને મીડિયા સેક્ટરમાં સારી એવી ધૂસણખોરી કરી લીધી છે. સૌથી આસાન રસ્તો મીડિયામાં મૂડીરોકાણ કરવાનો છે અને તેના પર ચીન આગળ વધી રહ્યું છે. ચીને મીડિયા કંપનીઓમાં હિસ્સેદારી મેળવી લીધી છે. સ્થાનિક મીડિયા સંગઠનો સાથે ભાગીદારી કરી છે અને તેનો ઉપયોગ પાકિસ્તાનમાં પોતાની છબી ઉજળી કરનારા કન્ટેન્ટને મીડિયા થકી લોકો સામે રજૂ કરવા માટે ચીન કરી શકે છે. ચીને પોતાની સરકારી મીડિયાનુ પણ પાકિસ્તાનમાં મોટાપાયે વિસ્તરણ શરુ કર્યું છે. પાકિસ્તાનમાં સરકારી મીડિયાની ઓફિસો શરુ કરવામાં આવી છે.

અહ્લાબાદ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

સાત ફેરા વગરના હિન્દુ વિવાહ કાયદેસર મનાય નહીં : કોર્ટ

પત્નીએ છૂટાછેડા લીધા વિના જ બીજા લગ્ન કરી લીધાં છે એટલા માટે તેને દંડિત કરવાની પતિની માગ કોર્ટે ફગાવી

। અહ્લાબાદ, તા.પ. । અહ્લાબાદ હાઈકોર્ટ એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે સાત ફેરાં અને અન્ય રીતિઓ વગર હિન્દુ વિવાહ કાયદેસર મનાય જ નહીં. હાઈકોર્ટે એક કેસ ફગાવી દીધો હતો જેમાં એક પતિએ આરોપ મૂક્યો હતો કે તેની પત્નીએ છૂટાછેડા લીધા વિના જ બીજા લગ્ન કરી લીધાં છે એટલા માટે તેને દંડિત કરવામાં આવે. સ્મૃતિ સિંહ નામની મહિલાની અરજી સ્વીકારતાં જસ્ટિસ સંજય કુમાર

સિંહે કહ્યું કે આ નિયમ જ છે કે જ્યાં સુધી તમામ વિધિઓ અને રીતિ-રિવાજો સાથે યોગ્ય રીતે લગ્ન સંપન્ન નહીં કરવામાં આવે ત્યાં સુધી એ લગ્નને સંપન્ન થયેલા ન માની શકાય. હાઈકોર્ટે કહ્યું કે જો લગ્ન કાયદેસર નથી તો કાયદાની નજરમાં પણ તે લગ્ન નથી. હિન્દુ કાયદા હેઠળ સમપટ્ટી એક કાયદેસરના લગ્નનું જરૂરી ઘટક છે પણ વર્તમાન કેસમાં આ પુરાવાઓનો અભાવ છે. હાઈકોર્ટે હિન્દુ લગ્ન એક્ટ, ૧૯૫૫ની કલમ ૭ને આધાર બનાવી છે

જે હેઠળ એક હિન્દુ લગ્ન સંપૂર્ણ વિધિ અને રીત-રિવાજ સાથે થવા જોઈએ જેમાં સમપટ્ટીએ લગ્નને સંપન્ન બનાવે છે. હાઈકોર્ટે મિરઝાપુરની કોર્ટના ૨૧એપ્રિલ, ૨૦૨૨ ના એ આદેશને રદ કરી દીધો જે હેઠળ સ્મૃતિ સિંહને સમન્સ જારી કરાયો હતો. હાઈકોર્ટે કહ્યું કે ફરિયાદમાં સમપટ્ટીના સંબંધમાં કોઈ ઉલ્લેખ જ કરાયો નથી. એટલા માટે આ કોર્ટના વિચારથી કોઈ અપરાધનો મામલો નથી બનતો કેમ કે બીજા લગ્નનો આરોપ નિરાધાર છે.



નવી દિલ્હીના પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે ન્યૂઝક્લિક પર પોલીસ દ્વારા કાર્યવાહી અંગે પત્રકારો દ્વારા વિરોધ કરવામાં આવ્યું હતું.

દક્ષિણના એક્ટર પવન કલ્યાણે એનડીએની સાથે છેડો ફાડ્યો

। નવી દિલ્હી, તા.પ. । ૨૦૨૪માં લોકસભા ચૂંટણી છે અને તમામ પાર્ટીઓએ પોતાની કમર કસી લીધી છે. ત્યારે આ વચ્ચે હવે બીજેપીને દક્ષિણથી મોટો ઝાટકો લાગ્યો છે. એક્ટર અને નેતા પવન કલ્યાણે આજે ભાજપ ના નેતૃત્વ વાળી એનડીએનો સાથ છોડવાનું અને દીડીપીનું સમર્થન કરવાનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે, આંધ્ર પ્રદેશને વિકાસ માટે

જનસેના અને દીડીપીની જરૂર છે. જેએસપી ચીફ પવન કલ્યાણે કહ્યું કે, દીડીપી એક મજબૂત પાર્ટી છે અને આંધ્ર પ્રદેશને સુશાસન અને વિકાસ માટે તેહલુ દેશમ પાર્ટીની જરૂર છે. આજે દીડીપી સંઘર્ષ કરી રહી છે અને અમે તેના સાથે છીએ. આ સ્થિતિમાં દીડીપીને જનસૈનિકોના યુવાનોની જરૂર છે. તેમણે આગળ કહ્યું કે, જો દીડીપી અને જનસેના

હાથ મિલાવી લેશે તો રાજ્યમાં વાઈએસઆરસીપીની સરકાર રૂબી જશે. ચંદ્રબાબુ નાયડૂની ધરપકડ બાદથી પવન કલ્યાણ આંધ્ર પ્રદેશની વાઈએસઆર જગનમોહન રેડ્ડીની સરકારથી નારાજ છે. જનસેના પાર્ટીના નેતા પવન કલ્યાણ ૧૪ સપ્ટેમ્બરના રોજ ચંદ્રબાબૂ નાયડૂ સાથે મુલાકાત કરવા માટે રાજમુંદ્રી સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા.



કેનેડાના ૪૧ રાજદૂતોને દેશ છોડવા ભારતનું અલ્ટિમેટમ

કેનેડાના રાજદ્વારીઓનને મળતી છૂટ ૧૦ ઓક્ટોબર પછી પાછી ખેંચાશે

ભારત અને કેનેડા વચ્ચે વિવાદ, રાજદ્વારી છૂટ વિદેશમાં તહેનાત રાજદ્વારીઓને કોઈપણ કિસ્સામાં ધરપકડમાંથી મુક્તિ આપે છે

। નવી દિલ્હી, તા.પ. ।

ભારત અને કેનેડા વચ્ચે વિવાદ હજુ યથાવત્ છે. આદરમિયાન ભારતે કેનેડાને તેના રાજદ્વારીઓને પરત બોલાવવા અલ્ટીમેટમ આપી દીધું છે. એક અહેવાલ અનુસાર ભારતે કેનેડાને તેના ૪૧ રાજદ્વારીઓને પાછા બોલાવવા કહ્યું છે. હાલમાં ભારતમાં ૬૨ કેનેડિયન રાજદ્વારીઓ છે. અહેવાલ મુજબ, અન્ય દેશોની તુલનામાં કેનેડાના નવી દિલ્હીમાં ઘણાં બધા રાજદ્વારીઓ છે. માહિતી અનુસાર ભારતે કેનેડાને તેના રાજદ્વારીઓને પરત બોલાવવા માટે ૧૦ ઓક્ટોબર સુધીનો

સમય આપ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો રાજદ્વારીઓ ૧૦મી પછી અહીં રહેશે તો તમામ પ્રકારની ડિપ્લોમેટિક ઈમ્યુનિટી (રાજદ્વારીને મળતી છૂટ) ખતમ થઈ જશે. જે લોકો વિદેશમાં રહીને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે છે તેમને રાજદ્વારી છૂટ આપવામાં આવે છે. તેનાથી વિદેશમાં આવા લોકોને કાયદાકીય રક્ષણ મળે છે. રાજદ્વારી છૂટની આ પરંપરા ઘણી જૂની માનવામાં આવે છે. આ તે દૂતને આપવામાં આવતી હતી જેઓ તેમના રાજાનો સંદેશ લઈને



અન્ય રાજ્યોમાં જતા હતા. બ્રિટાનિકા અનુસાર, રાજદ્વારી છૂટના કાયદામાં રોમન સામ્રાજ્યમાં વધુ મજબૂતી લવાઈ હતી. આજે વિદેશમાં તહેનાત રાજદ્વારીઓને આપવામાં

આવતી છૂટ ૧૯૬૧ના વિયેના કન્વેન્શનથી શરૂ થઈ છે. ભારત સહિત ૧૮૭ દેશો વિયેના કન્વેન્શન માટે સંમત થયા હતા. તે અનુસાર તમામ ‘રાજદ્વારી એજન્સી’ જેમાં ડિપ્લોમેટિક સ્ટાફ, વહીવટી, તકનીકી અને સેવા સ્ટાફનો સમાવેશ થાય છે. તે તમામને ગુનાહિત ક્ષેત્રમાંથી મુક્તિ આપવામાં આવી છે. વિયેના કન્વેન્શન વિદેશમાં તહેનાત રાજદ્વારીઓને સિવિલ કેસમાં પણ છૂટ આપે છે. જો કે મામલો ભંડોળ અને મિલકત સાથે સંબંધિત ન હોય તો. આ રાજદ્વારી છૂટ રાજદ્વારી અને

તેના પરિવારને પણ મળે છે. ગંભીર ફોજદારી કેસમાં રાજદ્વારી પરિવારના કોઈ સભ્યને છૂટ મળતી નથી. વિયેના કન્વેન્શનની કલમ ૯ કહે છે કે કોઈપણ દેશ કોઈપણ સમયે રાજદ્વારી સ્ટાફના પ્રમુખ કે કોઈપણ સભ્યને આપવામાં આવેલી છૂટ પાછી ખેંચી શકે છે. જો કોઈ દેશને લાગે છે કે રાજદ્વારી સ્ટાફના પ્રમુખ અથવા કોઈપણ સભ્ય વિશેષાધિકારનું ઉલ્લંઘન કરી રહ્યા છે અથવા રાજદ્વારી છૂટનો ગેરલાભ લઈ રહ્યો છે, તો તેની છૂટ રદ કરી શકાય છે.

એશિયન ગેમ્સમાં ભારતીય ટુકડીનો શાનદાર દેખાવ

આર્યરીમાં અને સ્કવોશમાં ભારતીય ટીમને ગોલ્ડ મેડલ

। હાંગઝોઉ, તા.પ. ।



દક્ષિણ કોરિયાને ૨૩૫-૨૩૦ના માર્જિનથી હરાવ્યું હતું. ભારતનો આ ૧૨માં દિવસનો અત્યાર સુધીનો આ ત્રીજો ગોલ્ડ છે. આ સાથે જ ભારતે એશિયન ગેમ્સ ૨૦૨૩માં અત્યાર સુધી કુલ ૨૧ ગોલ્ડ મેડલ જીતી લીધા છે. ભારત પાસે કુલ ૮૪ મેડલ છે જેમાં ૨૧ ગોલ્ડ જયારે ૩૧ સિલ્વર અને ૩૨ બ્રોન્ઝ મેડલ સામેલ છે.

ભારતને એશિયન ગેમ્સ ૨૦૨૩ના ૧૨માં દિવસે સૌ પ્રથમ આર્યરીમાં જ્યોતિ સુરેખા, અદિતિ સ્વામી અને પ્રણીત કોરે ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ત્યાર બાદ સ્કવોશ મિક્સ ડબલ્સમાં દીપિકા પલ્લીકલ અને હરિંદર સંધુએ બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. હવે કમ્પાઉન્ડ મેન્સ ટીમ આર્યરીમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. કમ્પાઉન્ડ મેન્સ ટીમ આર્યરીમાં ઓજસ દેવતલે, અભિષેક વર્મા અને જાવકર પ્રથમેશ સમાધાનની ટીમે

પાકિસ્તાની ક્રિકેટર હરિસ રઉફની દર્દભરી કહાની

પૈસાની એટલી તંગી હતી કે ફી ભરવા માટે ક્રિકેટ રમતો હતો

હારીસ રઉફના ઘરની હાલત પહેલા ઘણી દયનીય હતી, પહેલા સ્થિતિ એવી હતી કે તેની પાસે અભ્યાસ માટે પણ પૈસા ન હોતા

। નવી દિલ્હી, તા.પ. ।



પણ તે ખૂબ લાંબી સફર કાપીને આવ્યો છે. હારીસ રઉફના ઘરની હાલત પહેલા ઘણી દયનીય હતી. સ્થિતિ એવી હતી કે તેની પાસે અભ્યાસ માટે પણ પૈસા નહોતા. આવા સંજોગોમાં તે ક્રિકેટ રમતો અને મેચ જીતીને

પાકિસ્તાન ક્રિકેટ ટીમના જોરદાર ફાસ્ટ બોલર હરિસ રઉફને તો હવે આખી દુનિયા ઓળખે છે. વર્લ્ડકપ ટીમનો હિસ્સો એવો આ ખેલાડી પાકિસ્તાન માટે ૯૧ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેને ૧૩૭ સફળતા મળી છે. રઉફની લાર્ડફ સ્ટેડી પણ ઘણા ક્રિકેટરોની જેમ ઘણી રસપ્રદ છે. આજે આ ક્રિકેટર સફળ છે

મળેલી ઈનામની રકમથી પોતાની શાળાની ફી ભરતો. વર્લ્ડ કપ ૨૦૨૩ પહેલા વર્લ્ડ કપ વેબસાઈટે તેની સાથે ખાસ ઈન્ટરવ્યુ લીધો છે. આ વાતચીત દરમિયાન તેણે કહ્યું, ‘મારે ટેપ બોલ રમવાનું કારણ મારા અભ્યાસ માટે પૈસા ભેગા કરવાનું હતું, કારણ કે મારા પિતાની આવક મારી ફી ભરવા માટે પૂરતી ન હતી. આ સિવાય વધુ પૈસા કમાવવા માટે હું રવિવારે નાસ્તો વેચતો હતો.

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા તૈયાર કરાયું છે વાયુદળને દિવન સીટર લાઇટ કોમ્બેટ એરફાઇટ અર્પિત કરાયું

વિમાન ફાઇટર વિમાનની પણ કાર્યવાહી કરી શકે તેમ છે

। બેંગલુરુ, તા.પ. ।



હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચ.એ.એલ.) દ્વારા બુધવાર ભારતીય વાયુદળ (આઈએએફ) ને દિવન સીટર લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ અર્પિત કરાયું છે. આ વિમાન જરૂર પડે ફાઈટર વિમાનની પણ કાર્યવાહી કરી શકે તેમ છે. આ પ્રસંગે સંરક્ષણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી અજય ભટ્ટ મુખ્ય મહેમાન પદે હતા. આ પ્રસંગે રીલીઝ ટુ સર્વિસ તેમ જ સિગ્નલિંગ આઉટ સર્ટિફિકેટ (એસ.ઓ.સી.) પણ

રજૂ કરાયાં હતાં. આ પ્રસંગે ચીફ ઓફ એર સ્ટાફ, એર ચીફ માર્શલ વી.આર.ચૌધરી સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. આ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (એલ.સી.એ.) દિવન સીટર લાઈટ વેઈટ, ઓલ-વેધર મલ્ટી રોલ ટ.પ જનરેશનનું એરક્રાફ્ટ છે. તેમાં ટેકનોલોજીનાં વર્તમાન

ખ્યાલો જેવા કે, રીલેક્સડ સ્ટેટિક સ્ટેબિલીટી ક્વોટા પોક્સ ફ્લાય બાય વાયર કંટ્રોલ કેર ફી મોડયુલિંગ, એડવાન્સ ગ્લાસ કોકપીટ, ઈન્ટીગ્રેટેડ ડીજીટલ એવીયોનિક્સ સીસ્ટીમ્સ અને એડવાન્સડ કોમ્પોઝિટ મટીરીયલ્સ ફોર એર ફેમ, નો સમાવેશ કરાયો છે. તેમ પણ એચ.એ.એલ. દ્વારા કહેવામાં આવ્યું છે. આ વિમાન આત્મનિર્ભર ભારતની ખાદ્યમાં એક નવું છોગું બની રહેશે. તેમ સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે.

અભિનેત્રીને બરેલી એરપોર્ટ પર કડવો અનુભવ

નીના ગુપ્તાને રિઝર્વ લોન્જમાં એન્ટ્રી લેતી વખતે અટકાવવામાં આવ્યા હતા

। નવી મુંબઈ, તા.પ. ।



બોલિવૂડમાં વર્ષોથી પોતાના દમદાર અભિનયથી લોકોના દિલો પર રાજ કરતી અભિનેત્રી નીના ગુપ્તા સાથે તાજેતરમાં બરેલી એરપોર્ટ પર કંઈક એવું બન્યું હતું, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. નીના ગુપ્તા ૬૪ વર્ષની ઉંમરે પણ સ્કીન પર ઘણી એક્ટિવ છે. નીના તાજેતરમાં બરેલીમાં હતા. જો કે, એરપોર્ટ પર રાહ જોતી

વખતે તેમને રિઝર્વ લોન્જમાં એન્ટ્રી લેતી વખતે અટકાવવામાં આવ્યા હતા. આ ઘટના સંદર્ભે એક વીડિયો શેર કરીને નીનાએ લોકોનું ધ્યાન આ બાબત તરફ દોર્યું હતું.

વીડિયોમાં નીના હુમા એરપોર્ટ ઓથોરિટી પર પોતાનો ગુસ્સો નીકાળી રહ્યાં છે. એરપોર્ટ પરથી એક વીડિયો જાહેર કરતા નીના ગુપ્તાએ કહ્યું કે, ‘હું બરેલી એરપોર્ટ પરથી બોલી રહી છું. આ લો રિઝર્વ લોન્જ છે, જ્યાં હું એકવાર જઈને બેઠી હતી પણ આજે મને અંદર એન્ટ્રી આપવામાં આવી નહીં. મને લાગ્યું કે આ આરક્ષિત લાઉન્જ વીઆઈપી લોકો માટે છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાગરાજ-નંદીની સિંગલાના નામની હાલમાં ચર્ચા

બાગથી એડીશનલ સેક્રેટરી પદે નિયુક્ત કરાયા ત્યારથી તેઓને કોઈ પણ સ્થળે રાજદૂત પદે નિયુક્ત કરાશે તેમ મનાતું હતું

। નવી દિલ્હી, તા.પ. ।

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરવિંદમ્ બાગથી જીનીવા સ્થિત યુનોની કચેરીમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ (રાજદૂત) પદે નિયુક્ત થવાના છે તેમ માહિતગાર સૂત્રો જણાવે છે. બાગથીના સ્થાને જી-૨૦ સમિટ સમયે જોઈન્ટ સેક્રેટરીપદે હતા તે નાગરાજ નાયક કાકાનુર કે. કે. નંદીની સિંગલાના નામ ચર્ચાઈ રહ્યા

હોવાનું પણ જાણવા મળ્યું છે. નંદિની અત્યારે મોરેશ્યસમાં હાઈ કમિશ્નર પ દે છે. ૧૯૯૫ની બેચના ઈન્ડિયન ફોરેન સર્વિસ (આઈએફએસ)ના બાગથીએ ૨૦૨૧માં વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરીકેનો હોદ્દો માર્ચ ૨૦૨૧માં સંભાળ્યો હતો તેઓની કારકિર્દી ઘણી કઠોર પણ હતી. કોવિદ-૧૯ મહામારી અને

ચીન સાથેના લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલ.એ.સી.) પર થયેલા સંઘર્ષ સમયે વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરીકે તેઓની શક્તિ અને સમજદારીનું પ્રમાણ નિશ્ચિત થઈ ગયું હતું. વાસ્તવમાં તેઓને એડીશનલ સેક્રેટરી (વિદેશ મંત્રાલય) પદે નિયુક્ત કરાયા ત્યારથી તેઓને કોઈ પણ સ્થળે રાજદૂત પદે નિયુક્ત

કરાશે તેમ માનવામાં આવતું હતું પરંતુ જી-૨૦ શિખર પરિષદ સુધી તે નિર્ણય મોકુફ રખાયો હશે તેમ પણ જાણકારોનું કહેવું છે. કાકાનુરની વાત લઈએ તો જી-૨૦ના શેરપા અમિતાભ કાંત સાથે રહી જી-૨૦નું સંયુક્ત નિવેદન ઘડવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવીહતી. તેઓ ૧૯૯૮ની બેચના આઈએફએસ અધિકારી છે.



તંત્રી લેખ...

શિક્ષણની નબળી સ્થિતી

હજારો વર્ષો પહેલા તક્ષશિલા અને નાલંદા યુનિવર્સિટીના માધ્યમથી દુનિયાભરમાં શિક્ષણના ક્ષેત્રમાં ડંકો વગાડનાર ભારતમાં હવે ભલે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ સૌથી વધારે છે પરંતુ તેની ગુણવત્તાને લઈને હવે સ્થિતી ચિંતાજનક છે. શિક્ષણની ગુણવત્તાના મામલે હવે ભારત ખુબ પાછળ રહી ગયું છે. અમારી હાવડ ગણતી સેન્ટ્રલ યુનિવર્સિટીઓની હાલતનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે આમાં ૩૭ ટકા શૈક્ષણિક જગ્યાએ ખાલી પડેલી છે. શિક્ષણના મામલે જગતગુરૂ ગણાતા ભારતમાં આવી સ્થિતી કેમ થઈ છે. અમે ગુણવત્તામાં કેમ સુધારો કરી શકતા નથી, સુ રાજકીય પ્રભાવમાંથી આને મુક્ત કર્યા તેમાં સુધારો તઈ શકે ચે કે કેમ તે વિષય પર આજે અમે ચર્ચા આ લેખ મારફતે કરવા જઈ રહ્યા છીએ. જાણકાર નિષ્ણાંત અને યુજીસીના પૂર્વ સભ્ય એમ એમ અંસારીનુ કહેવુ છે કે શિક્ષણને સમાજ અને ઉદ્યોગો સામે જોડવામાં આવે તે ખુબ જરૂરી છે. વર્તમાન સમયમાં ડીજીપીના એક ટકાથી પણ ઓથી રકમ શિક્ષણ પર ખર્ચ કરવામાં આવે છે. સ્તરને સુધારવા માટે શિક્ષણ પર કરવામાં આવતી ખર્ચની રકમને વધારીદેવાની જરૂર છે. સંશાધનો પુરતા પ્રમાણમાં વિકસિત કરવામાં આવે તે જરૂરી છે. તેમનુ કહેવુ છે કે અમારા દેશની યુનિવર્સિટીઓમાં શિક્ષણનુ વાતાવરણ અને સ્તર એ સ્તરનુ નતી જે સ્તરનુ દુનિયાના અન્ય ક્ષેત્રમાં જોવા મળે છે. વાતાવરણ માટે એ જરૂરી છે કે યુનિવર્સિટીઓને રાજકીય અપાડા બનવાથી રોકવામાં આવે. યુનિવર્સિટીઓ અભ્યાસ માટે છે. જેથી યુનિવર્સિટીને તેમનુ કામ તેમની રીતે કરવાની તક આપવી જોઈએ. યુનિવર્સિટીઓને જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવવામાં આવે પરંતુ કમનસીબ રીતે આજે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી નથી. વાતાવરણમાં સુધારો કરવો ખુબ જરૂરી છે. અમારા દેશની યુનિવર્સિટીઓમાં રાજકીય પ્રભાવ તરફ ધ્યાન આપવામાં તો તેમની નિમણૂંકની પ્રક્રિયા પર ધ્યાન આપીને સરળતાથી સમજી શકાય છે. જે વ્યક્તિ શિક્ષણ જગત સાથે કોઈ સંબંધ ધરાવતા નથી તે વ્યક્તિને કુલપતિ બનાવી દેવામાં આવે છે. ત્યારબાદ ભણાવવા માટે શિબજીકોની નિમણૂંકમાં પણ આવી જ શરૂઆત થઈ જાય છે. ઉમેદવારોની રાજકીય ઓળખ છે તો તેમને તરત તક આપી દેવામાં આવે છે. જે નેતાઓ નિમણૂંકના મામલે જોડાયેલા છે તે લોકો સમગ્ર પ્રક્રિયાને આગળ વધારે છે. શિક્ષણ જેના નામે યુનિવર્સિટીઓ બની છે તેનાથી અમારુ ધ્યાન હવે દુર થઈ રહ્યું છે. જે વ્યક્તિના રાજનિતી સાથે કોઈ લેવાદેવા નથી જે વ્યક્તિ માત્ર શિક્ષણને લઈને સમર્પિત છે તે વ્યક્તિને શિક્ષણથી દુર રાખવામાં આવે છે. શિક્ષણને સમાજ અને ઉદ્યોગો સાથે જોડી દેવામાં આવે તે ખુબ જરૂરી છે. દાખલા તરીકે અમે એવા કામ કરી શકતા નતી જ્યારે કોઈ મોટા મિશન હાથ ધરવામાં આવે છે. દાખલા તરીકે જ્યારે સ્વચ્છ ભારત અભિયાન ચાલે ત્યારે તેને યુનિવર્સિટી સાથે જોડી દેવામાં આવે તેવી વ્યવસ્થા અમે ધરાવતા નથી. આવની સ્થિતીમાં સમાજ અને ઉદ્યોગો સાથે શિક્ષણને જોડવાની ખુબ જરૂર રહેલી છે.

બિઝનેસ વ્યવસ્થિત રાખો

બિઝનેસ ફાયનાન્સને વ્યવસ્થિત કરીને સફળતા હાંસલ કરી શકાય છે. પર્સનલ ફાઈનેન્સની જેમ જ આપને નાના ફાઈનેન્સને પણ વ્યવસ્થિત રાખવાની જરૂર હોય છે. કેટલાક ખાસ પગલા લઈને બિઝનેસના નાના ફાઈનાન્સને પણ આરામથી વ્યવસ્થિત રાખી શકાય છે. તેમને ટ્રેક કરી શકાય છે. આ રીતે તમે તમારા બિઝનેસને સફળતાપૂર્વક ચલાવી શકો છો. સાથે સાથે લક્ષ્યને સફળતાપૂર્વક હાંસલ કરી શકાય છે. બિઝનેસ શરૂ કરવાની બાબત ચોક્કસપણે પોતાની રીતે મોટી બાબત છે. આમાં આપની પાસે લાંબી ટુ ડી લિસ્ટ હોય છે.આમાં સમય સમય પર અલગ અલગ કામો પણ કરવા પડે છે. આવી સ્થિતીમાં આ તમામની સાથે કામ પાર પાડવા માટેની બાબત પણ સરળ હોતી નથી. જો કે જો બિઝનેસથી વધારે પૈસા મળી રહ્યા નથી તો તે તે એક ઈચ્છાથી વધારે રહેતા નથી. પોતાના નાના બિઝનેસને યોગ્ય રીતે મેનેજ કરવા અને વ્યવસ્થિત રાખવાની બાબત હમેશા ઉપયોગી સાબિત થાય છે. આના કારણે સફળતા હાંસલ કરી શકાય છે. આનાથી બિઝનેસને સફળતાની દિશામાં લઈને આગળ વધી શકાય છે. પોતાના પ્રોફિટ ગોલને હાંસલ કરવા માટે કેટલાક નક્કર માર્ગ અપનાવવા પડે છે. પર્સનલ ફાઈનાન્સની જેમ જ એવા અનેક તરીકા છે જેના કારણે આપ બિઝનેસ ફાઈનાન્સને વ્યવસ્થિત રાખી શકો છો. સામાન્ય લોકો અને જાણકાર નિષ્ણાંતો કહે છે કે આપના બિઝનેસને વ્યવસ્થિત રાખવા માટે સૌથી પહેલા હાર્ડ કોપીને સોફ્ટ કોપીમાં ફેરવી નાખવામાં આવે તે જરૂરી છે. બિઝનેસને વ્યવસ્થિત કરવા માટે આપને પોતાના મોટા ભાગના ફાઈનાન્સિયલ પેપરવર્કને ડિજિટાઇઝ કરી દેવાની જરૂર હોય છે. તમે તમારા દસ્તાવેજને ડિજિટલી સેવ કરી શકો છો. સાથે સાથે થર્ડ પાર્ટી સર્વિસનો ઉપયોગ કરીને તેમને બચાવી શકાય છે. આપને તમામ ચીજો ક્રોમ્પ્યુટર પર સાચવીને રાખવાની પણ કોઈ જરૂર નથી. જો તમે કોઈ હાર્ડ કોપી રાખવા માટેની ઈચ્છા ધરાવો છો તો તમે તેને કેટેગરીની ટ્રિપ્લિએ વિભાજિત રાખી શકાય છે. રીમને કેબિનેટમાં વ્યવસ્થિત રીતે રાખી શકાય છે. બિઝનેસને સુરક્ષિત રાખવા માટે કેટલાક પગલા જરૂરી હોય છે. બિઝનેસને પોતાના સ્તર પર સુરક્ષાની જરૂર હોય છે. આના માટે આપને પોતાના બિઝનેસ માટે વીમા લેવાની પણ જરૂર હોય છે. આના કારણે તમે તમારા બિઝનેસની એક અલગ ઓળખ ઉભી કરી શકો છો. સાથે સાથે બિઝનેસ ફાઈનાન્સને પણ ખાનગી ફાયનાન્સ કરતા અલગ રાખી શકાય છે. જો તમે ઈચ્છો છો કે એવા ફાઈનાન્સલ મામલા જેના કારણે બિઝનેસ પર માઠી અસર થઈ રહી છે તેનાથી આપની અંગત સંપત્તિ બચી રહે તો આના માટે બિઝનેસને સુરક્ષિત રાખવાની જરૂર હોય છે. આવી રીતે આપ આપના બિઝનેસ ફાઈનેન્સને વધારે વ્યવસ્થિત રાખી શકો છો અને સાથે સાથે સુરક્ષિત પણ રાખી શકો છો. બિઝનેસના નાના ફાઈનાન્સને વ્યવસ્થિત રાખવા માટે આપને આ બાબત જાણવી ખુબ જરૂરી છે કે આપની આવક દરેલી થઈ રહી છે. આપ આપની માસિક, સાપ્તાહિક અને દરરોજની કમાણી કેટલી કરી રહ્યો છો. આ બાબત જાણવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી છે. પોતાના બિઝનેસ માટે કેટલી રકમ ઉભી થઈ રહી છે તે બાબત જાણવી જરૂરી છે. આપ આના માટે એક સ્પ્રેડશીટનો ઉપયોગ કરી શકો છો. સાથે સાથે આપ પોતાની કમાણીને કેટેગરીજમાં વિભાજિત કરી શકો છો. આ રીતે તમે કમાણીને ટ્રેક કરી શકો છો. સાથે સાથે પોતાના ફાઈનાન્સને યોગ્ય રીતે વ્યવસ્થિત રાખી શકો છો. પોતાના ખર્ચને ટ્રેક કરવામાં આવે તે બાબત પણ જરૂરી છે. જો તમે તમારી કમાણીના ટ્રેક રાખી રહ્યા છો તો તે બાબત અસરકારક સાબિત થઈ શકે છે. ખર્ચને પણ ટ્રેક કરવાની જરૂર હોય છે. એન્ટરપ્રેન્યોર્સની પાસે કેટલાક જરૂરી ખર્ચ હોય છે.

સૌ સંકલ્પ લે ગમે તે થાય, સમયની સુક્ષ્મ હથોડીએ ટીપાઈને સહુ સુવર્ણ જેમ પોતાનું જીવન નિખારશે, અને વળી આપણી આ હિંદુ સંસ્કૃતિ ઉચ્ચ સ્તરે બિરાજમાન થશે



સદગુરુ પ્રયનામૃત

સંકલન ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. કોઈપણ ઘટનામાંથી શુભ તારવું હોય તો કોઈ નિષ્કર્ષ પર આવવું પડે, અને જીવનની રાહ ઉજાળવી પડે, કારણ કે અહીં સતત વ્યક્તિગત રીતે કે સામાજિક રીતે કંઈ ને કંઈ ઘટતું હોય છે, અને એમાંથી આપણે આપણી બુદ્ધિ પ્રમાણે માર્ગ કાઢી જીવવાનું હોય છે. બાકી સૂર્ય, સમય, અને સદગુરુ એ નિરંતર શુભ મંગલની વર્ષા કરી રહ્યા છે, અને જીવનને શુભ બનાવવાના ગીત ગાઈ રહ્યા છે. આજે આપણે આવા ભાવનો સંદર્ભ લઈને તરાને કી તર્જ જીવન કા અર્કમાં આગળ ચિંતન કરીશું. ૧૮૫૯ માં બનેલી જીને કી રાહ, ફિલ્મનું આ ગીત છે જોતેન્દ્ર અને તનૂજા એ આ ફિલ્મમાં મુખ્ય કિરદાર નિભાવ્યો હતો, મહમદ રફી દ્વારા આ ગીત ગવાયું હતું, તેમજ ફિલ્મના સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને ગીતના શબ્દો આનંદ બક્ષી સાહેબના છે. આપણે આપણા જીવનમાં આવતી સમસ્યાને અજવાળવા ક્વિ એ લખ્યા મુજબ કોઈ એક બંજારા સામાન્ય રીતે બંજારા નું કોઈ નિશ્ચિત ઠેકાણું નથી હોતું, અને એ સતત વર્તમાન જીવન પ્રેરિત જીવતા હોય છે. આપણી માટે તો સદગુરુ જ એક બંજારા બનીને રોજ ચિંતનનું નવું ગીત લઈને આવે છે, અને એમ આપણે જીવન અજવાળી શકીએ. લોકો ત્રણ સ્તરે પોતાના જીવન અજવાળી શકે, અથવા તો ત્રણમાંથી શીખ લઈ અને જીવનની રાહ અજવાળી શકે! તો ક્વિ એ લખ્યા મુજબ જીવન કોઈ સતત આપણને જીવનની રાહ તરફ આંગળી ચીંધી રહ્યું છે, અને એનામાં કાગળ ના ફૂલમાં પણ સુગંધ ભરવાની ક્ષમતા છે. કોઈ કોઈ વાર જીવનમાં એવી ઘટના ઘટે કે એમાંથી ઉપર ઉઠવું બહુ મુશ્કેલ થાય, જીવનનું સત્ય છે, કે અહીં જન્મ મૃત્યુને સ્વીકારવું પડે. પરંતુ કોઈ કોઈવાર અંગત સ્વજનનું મૃત્યુ, બધા જ શાશ્વત સત્યો જાણવા છતાં સ્વીકારી શકાતું નથી. કોઈવાર કોઈ ગંભીર બીમારી થાય, એક્સિડન્ટ થાય, કે શરીરનું અંગ ચાલ્યું જાય અથવા સ્વજન એ રીતે પીડાતું હોય, ત્યારે પણ સંજોગો વિપરીત લાગે. કોઈ વાર કોઈ દગો કરે, વિશ્વાસઘાત કરે, તો એ પરિસ્થિતિમાંથી પણ ઉપર ઊઠવું બહુ મુશ્કેલ લાગે. પરંતુ સમય દરેક દર્દની દવા છે, એવી આપણે ત્યાં એક કહેવત છે, અને સમય છે વીતી જશે! એવી એક હેયાધારણા લઈ અને આપ ણે જીવનમાં ઉપર ઊઠવાની કોશિશ કરતા હોઈએ છીએ, કામચાબ પણ થતા હોઈએ છીએ, અને ફરી પાછું જીવન સામાન્ય થઈ જીવતા હોઈએ છીએ. એટલે એક બંજારા તરીકે આપણે સમયને પણ લઈ શકીએ, એ જ રીતે સૂર્ય છે એ રોજ ઉદય થાય છે, વળી પાછો અસ્ત થાય છે, વળી ઉદય થાય છે. એટલે કે સૂર્ય સૌના જીવન પ્રકાશિત કરે છે, છતાં તેને અસ્ત થવું પડે છે, અને ફરી પાછું ઉદય થવું પડે છે, એ નિરંતર સત્ય તરીકે આપણી સમક્ષ રહી શકતો નથી. હા તેનો અસ્ત એક ભૌગોલિક ઘટના છે, પણ આપણી સામે તો



આજ સત્ય છે. એટલે ક્યારેક ક્યારેક પ્રકાશિત થવા માટે, કે કોઈના પ્રકાશિત વ્યક્તિત્વને ગુમાવ્યા બાદ, આવું આશ્વાસન લઈ આપણે ઉપર ઉઠતા હોઈએ છીએ. તો સમય કે સૂર્ય પણ જો આપણને શીખ આપી શકતા ન હોય, અથવા તો આપણે એમાંથી કંઈ ગ્રહણ કરી અને જીવન અજવાળી શકતા ન હોઈએ, તો કોઈ નિશ્ચિત જગ્યાએ શરણાગત થવાથી પણ આપણા પ્રશ્નોનો હલ નીકળતો હોય છે, અને જીવન એક નવા આયામમાં પ્રવેશે એવું પણ બને. આપણી આજ સુધીની તમામ ફરિયાદો, તકલીફો, પીડા તેમજ રહસ્યને સદગુરુ ઉકેલે છે, અને એક નિર્મળ જીવન જીવી શકાય એવું બોજ રહિત આપણું જીવન બનાવે છે. આપણા જીવનમાં જે આજ સુધી સંઘર્ષ હતો, એ આપણા જ અમુક આગ્રહ કે અહમ્મ ને કારણે હતો, એવું સત્ય પણ તે સમજાવે છે. પરંતુ અહીં મૂળમાં એક વાત એ છે કે, આપણી અદમ્ય ઈચ્છા હોવી જોઈએ કે આપણે આ જીવન નથી જીવવું. આપણે કંઈક સારું કરવું છે, અથવા તો સારા કાર્યના નિમિત્ત બનવું છે. ઘટી રહેલી ઘટના માટે આપણા હૃદયમાં પીડ હોવી જોઈએ, કે આવું શું કામ થાય છે! સતત આવી સંવેદનાનું ઝરણા વહેવું જોઈએ, કે ના હું મારા જીવનના અંત પહેલા આ માનસિકતા માંથી બહાર આવીને જ રહીશ, એવો સંકલ્પ પણ કરવો પડે, તોજ અલૌકિકતાનો સૂર્ય ઉદય પામે, અને એવું થાય પણ ખરું! પરંતુ દ્રઢ મનોબળ અને દ્રઢ વિશ્વાસની કમી ન હોય એ પણ જરૂરી છે. જેણે જેણે આ દુનિયામાં કોઈ ઉપલબ્ધિ મેળવી છે, કોઈ ધ્યેય સિદ્ધ કર્યું છે, કે લક્ષ્યાંક સુધી પહોંચ્યા છે, એ બધાના મનોબળ દ્રઢ હશે, એમણે પોતાની આસપાસ ઘટતી ઘટનાઓ માંથી શીખ લીધી હશે, અથવા તો આસપાસ થતી સ્તુતિ નિંદાથી ઊઠી અને જીવનમાં કંઈક સત્ય હાંસલ કરવા માટે પ્રયત્ન કર્યો હશે, કે પછી કોઈ નિશ્ચિત ઠેકાણે પોતાની જાતને પૂર્ણ સમર્પણ કે શરણાગતિ સ્વીકારી, એમ એ જીવનના તટ પર નિશ્ચિત થઈ બેસી ગયો હશે.

સંસારના જડપદાર્થો સાથે અતિ સ્નેહ કરવાથી જડા વ્યાસ પણ વધે છે, તપથી અંત: કરણની જડશુદ્ધિ થાય છે



વિશેષ

યશપાલસિંહ ટી. વાઘેલા

ભાગવત સર્વને માટે છે ઘર છોડી તપશ્ચર્યા કરનાર માટે અને ઘરમાં રહેનાર માટે ભાગવતની કથા એ માર્ગદર્શક છે એવું નથી કે ઘર છોડનારને ભગવાન મળે છે. પ્રહલાદજીને ઘરમાં જ ભગવાનના દર્શન થયા છે ઘરનું વાતાવરણ પ્રતિકૂળ હતું તેમ છતાં પ્રહલાદ ઘરમાં જ ભજન કરી શક્યા છે. મનુષ્ય જીવનમાં લક્ષ્ય નક્કી કરવાની બહુ જરૂર છે લક્ષ્યે ધ્યાનમાં રાખી બધો વ્યવહાર કરો ઘર ભક્તિમાં ભાજપ છે એમ માની ભરતજી ઘર છોડીને વનમાં ગયા હતાં ત્યાં પણ ભક્તિ કરી શક્યા નથી જ્યાં જીવ ત્યાં આ પયવીશયો સાથે આવે છે ઘરમાં રહીને ભક્તિ કરવી હોય તો પ્રહલાદ નો આદર્શ નજર સમક્ષ રાખો વનમાં રહીને ભક્તિ કરવી હોય તો ભરતનું જીવન લક્ષમાં રાખો જીવ જ્યાં જાય ત્યાં તેની પાછળ જ છ ચોરો પડેલા છે કામ ક્રોધ લોભ મો મધ અને મત્સર આ વિકારો પાછળ આવે છે આ વિકારોને વર્ષ ન થઈ ઘરમાં રહે તો ઘર બાધક થતું નથી આ ચોરો સામે ઊલટું ઘરમાં રહી આ શત્રુ ઓને જીતવાનું સહેલું છે. ફસાતા નથી.ગૃહસ્થને પૈસો છોડવો કામસુખ છોડવું એ અઘરું છે.પણ એનાથીયે અધ મહાત્મા ઓએ આ સિદ્ધિઓમાંથી છૂટવું તે છે. જ્ઞાની મહાત્માઓને આ સિદ્ધિ ફસાવે છે.ઋષભદેવજી તો નગ્ન રીતે ફરે છે, ઊભા થાય છે, બળદ ની જેમ ભાજી આરોગે છે. કોઈ મારે ત માને શરીરને માર પડે છે. મને શું? હું કોઈ શરીર નથી.શરીર થીઆત્મા જુદો છે.તે જાણે છે. પણ અનુભવે છે કોઈક નાળિયેર માં કાયલી- કોપ રું એક નથી,છતાં નાળિયેરમાં જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી કાયલી કોપરાને છોડતી નથી. તેમ મનુષ્યમાં જ્યાં સુધી વિષયરસ છે, વિષયાસક્તિ છે ત્યાં સુધી શરીર અને આત્મા જુદાં છે તેનો અનુભવ થતો નથી. કાયલી એ શરીર અને કોપરં પાણી એ વિષય રસ છે. સંસારની કોઈ વસ્તુમાં સ્નેહ હોય ત્યાં સુધી શરીરથી આત્મા જુદો છે એમ લાગતું નથી. નામ રૂપનો મોહ છૂટતો નથી, ત્યાં સુધી આત્મા શરીરથી જુદો છે. એમ દેખાતું નથી. ઊલટો દેહાધ્યાસ વધે છે.સંસારના જડપદાર્થો સાથે અતિ સ્નેહ કરવાથી જડા વ્યાસ પણ વધે છે.તપથી અંત: કરણની જડશુદ્ધિ થાય છે,ને બ્રહ્મસુખ મળે છે ને બ્રહ્મજ્ઞાનની વાતો કરે, પણ પૈસો અને પ્રતિષ્ઠા સાથે પ્રેમ કરે એ ખરો જ્ઞાની નથી. ખરો જ્ઞાની એ જ કે ઈશ્વર સાથે જ પ્રેમ કરે.ઈશ્વર વિના સંસારના જડપદાર્થમાં સ્નેહ થાય તે આત્માને શરીરથી જુદો જોઈ શકે નહીં.હું શરીર નથી.હું સર્વનો સાક્ષી ચેતનઆત્મા આનંદ રૂપ છું, એવું બ્રહ્મ જ્ઞાન થયા પછી પણ તેને સંસારના વિષયો સાથે પ્રેમ હશે તો તેને બ્રહ્માનંદ મળશે નહીં બ્રહ્મ જ્ઞાન થયા પછી ઈશ્વરમાં પ્રીતિ થાય તો બ્રહ્માનંદ મળે છે, આથી જ્ઞાની પુરુષે કોઈપણ વસ્તુમાં સ્નેહ કરવો નહીં. કોઈપણ વસ્તુનો સંગ્રહ કરવો નહીં.



જેઓ મૃત્યુરૂપ સંસારમાં ફસાયેલા બીજા લોકોને તારી ન શકે તેવો ગુરુ એ ગુરુ નથી, સ્વજન એ સ્વજન નથી, પિતા એ પિતા નથી અને માતા એ માતા નથી. એટલે કે માતા થવાને લાયક નથી.ગુરુ,સ્વ જન,પિતા-જ્ઞાનની સાતભૂમિકાઓ યોગ વિશલ રામા યણમાં આ પ્રમાણે બતાવેલી છે: શુભેચ્છા, સુવિચારણા, તનુ, માનસા, સત્ત્વાપતિ, અસંસકિત. પદાર્થ ભાવિની, તુમણ. શુભેચ્છા : શ્લોત્રીય અને બ્રહ્મનિષ્ઠ ગુરુને કરણે જઈ તેમના માર્ગદર્શન પ્રમાણે આત્માનો સાક્ષાત્કાર કરવાની ઉત્કટ ઈચ્છા તે શુભેચ્છા. સુવિચારણા:સદગુરુ એ ઉપદેશ કરેલ વચનોનો તથા શાસ્ત્રોનો વારંવાર વિચાર તે વિચારણા તનુ માનસા: શ્રવણ, મનન નિદિધ્યાસનથી શબ્દાદિ વિષયોમાં અનાસકિત થાય અને સવિકલ્પ સમાધિમાં અભ્યાસ વડે બુદ્ધિના તત્તુતા સૂક્ષ્મતા પ્રાપ્ત થાય છે. ઃ.સત્ત્વાપતિ ઉપરના ત્રણથી સાક્ષાત્કાર પ્રયંતની સ્થિતિ એટલે નિર્વિકલ્પ સમાધિરૂપે સ્થિતિ એ સત્ત્વાપતિ. જ્ઞાનની ચોથી ભૂમિકા વાળો પુરુષ બ્રહ્મવિતા કહેવાય છે. પ.અસંસકિત:ચિત્ત વિશે પરમા નંદ અને નિત્ય અપરોક્ષ એવી બ્રહ્માત્મ ભાવનાનો સાક્ષાત્કાર તે અસંસકિત. એમાં અવિદ્યા તથા તેનાં કાર્યોનો સંબંધ નથી. તેનું નામ અસંસકિત. દ.પદાર્થભાવિની પદાર્થોની દૃઢ અપ્રતીતિ થાય છે તે. ઊ.તુયંગા ત્રણ અવસ્થાથી મુક્ત, બ્રહ્માને જે અવસ્થામાં આત્મારૂપે અખંડ જાણે તે અવસ્થા.

આ સાતમા પ્રથમ ત્રણ સાધન કોટિની છે.બાકીની ચાર જ્ઞાન કોટિની છે. ત્રણ ભૂમિકાઓ સુધી સગુણ બ્રહ્મનું ચિંતન કરો, જ્ઞાનની પાંચમી ભૂમિકાએ પહોંચતા જડ અને ચેતનની ગ્રંથિ છૂટી જાય છે અને આત્માનો અનુભવ થાય છે. આ ભૂમિકાઓ ઉત્તરોત્તર દેહનું ભાન ભૂલાતું જાય છે, અને છેવટે મળે છે, આથી જ્ઞાની પુરુષે કોઈપણ વસ્તુમાં સ્નેહ કરવો નહીં. કહેલી. જ્ઞાનીઓ પણ ઈન્દ્રિયોથી ડરે છે. તેઓ ઈન્દ્રિયો ઉપર

સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા આ જ તો ઈચ્છે છે, કે એકવાર તું મારા શરણે આવી જા! પછી હું તારું જીવન સંવારીશ ! પરંતુ નથી આપણે સંપૂર્ણ શરણાગત થઈ શકતાં, કે નથી ખુદ ઊઠવાની કોઈ કોશિશ કરતાં. આપણે તો જે છે, તેમાં જ જીવવા ટેવાયેલા છીએ, જ્યાં ફરિયાદની કોઈ જરૂર નથી ત્યાં ફરીયાદ કરીએ છીએ, અને જ્યાં સહન કરવાની કોઈ જરૂર નથી અથવા તો ફરિયાદનો ભાવ હોવો જોઈએ, કે આવું સમાજમાં કેમ થાય છે, એની માટે ક્યાંક હું પણ કારણભૂત નથી ને? એવા પ્રશ્નો થવા જોઈએ. ત્યાં સહનશક્તિનો આંચળો ઓઢીને નીંદનીય ઘટનાઓ પણ સહન કરી લેતા હોઈએ છીએ, માટે કંઈ થઈ શકતું નથી. બાકી સૂર્ય પણ આટલા વર્ષોથી નિરંતર પ્રકાશની સાથે સાથે પોતાનું સત્ય પ્રકાશિત કરી રહ્યો છે, સમય પણ સૌને જગાડવા માટે પ્રવૃત્ત છે, પણ જીવન છે, આવું તો ચાલે રાખે! એમ સમાધાન લઈ લેતા હોઈએ છીએ.

હકીકતમાં જ્યાં જાગવાની જરૂર હોય ત્યાં આવી જ રીતે મોહ નિંદ્રામાં સુતા રહીએ છીએ, અને સદગુરુ એની વિશે તો શું કહીએ!! માત્ર એક દીસ ઊઠે અંતરમાં અને એક સ્મરણ થતાં સાત કોઠે દીવા પ્રગટી જાય, એટલી તત્પરતા એ આપણા માટે બતાડે છે. પણ “જો અને તો” કોઈ ઈચ્છા કે જિજ્ઞાસા જ ના થાય, તો સદગુરુ આખરે શું કરે!; ફરી સૂર્યમાં ઉદય થઈ રહ્યો છે, એ મને હિન્દુ સંસ્કૃતિના ઉત્થાનની આશા જગાડે છે. સમયની સુક્ષ્મ હથોડી એ ટીપાઈને સહુ સુવર્ણ જેમ પોતાનું જીવન નિખારશે, અને વળી આપણી આ હિંદુ સંસ્કૃતિ ઉચ્ચ સ્તરે બિરાજમાન થશે. આપણે પણ ગાઈશું, એય મેરે વતન એર વતન આબાદ રહે તું, કવિની પરિકલ્પના મુજબનું ભારત આપણે બનાવવું જ રહ્યું. આપણા સૌનો હિન્દુસ્તાનની સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયત્ન સફળ થાય એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહવંદન અને જય સીયારામ.

વિશ્વાસ રાખતા નથી. મનનો વિશ્વાસ તો કદી પણ ન કરવો. બોલવાની ઈચ્છા જ ન થાય એટલા માટે ઋષભદેવજી પોતાના મોઢામાં પથરા રાખતા. ઋષભદેવજી કણાટકમાં આવ્યા. દાવાગિનમાં સમજપૂર્વક પ્રવેશ કર્યો. દેહ બળે છે, આત્માને કંઈ થતુંનથી આવી આત્મનિષ્ઠા એ પરમ હંસો માટે છે.

ઋષભદેવનું ચરિત્રસામાન્ય માટે અનુકરણીય નથી. ઋષભદેવજી પછી તેમના પુત્ર ભરત ગાદી ઉપર બેઠા. જેના નામ પરથી આ દેશનું નામ ભરતખંડ પડ્યું છે. ભરતજીની કથા વર્તમાન કાળમાં વિશેષ ઉપયોગી છે. ભરતજી પરમ ભાગવત છે.

તેના સંસર્ગમાં આવનાર સર્વમાં ભાગવત ભાવ જાગતો હતો. ભક્તિનો રંગ લાગતો હતો. ભરતજીએ વ્યવહારની મર્યાદા કોઈ દિવસ છોડી નથી. ભરતજી મહાવૈષ્ણવ હતા, તો પણ ચલ કરતા હતા.

અગ્નિ તો ઠાકોરજીનું મુખ છે. ભરતજી યજ્ઞો કરી તેનું પુણ્ય શ્રીકૃષ્ણના ચરણમાં અર્પણ કરતા. કર્મનું ફળ પ્રભુને અર્પણ કરવાથી કર્મનું અભિમાન રહેતું નથી. ઈશ્વરની સાથે ખૂબ પ્રેમ કરો તો જ કરેલાં કર્મનું પુણ્ય પરમાત્મા ને અર્પણ કરી શકો.પત્ની મહેનત વધુ કરે છે પણ તેનું ફળ આપે છે પતિને, તેમ ભક્ત પોતાના તમામ કર્મનું ફળ પ્રભુને સમર્પે છે. સકામ કર્મની ભાગવતમાં નિંદા કરી છે. સકામ કર્મમાં કંઈક ભૂલ થાય તો તેની ક્ષમા મળતી નથી.ભરત નિષ્કામ ભાવથી ક્રમ કરતાં અને તેનું પુણ્ય શ્રીકૃષ્ણને અર્પણ કરતા. વાયક ચાહક મિત્રો, પિતૃ તપ્ત્ણ અર્પણનું મહાપવ્ શ્રાધ્ધ પણ ચાલી રહયો છે.આજે આઠમનું શ્રાધ્ધ થશે. સમય સમયનું કામ કરે છે. આપણે તેની સાથે ચાલવા પ્રયત્ન કરીશું તો જ નિધારિત મંજિલ સુધી પહોંચવામાં કોઈ જાતની તકલીફ નહી પડે બાકી તો ભટકતા જ રહેવાનું છે.

સવારે ઉઠીને ચાલવાના આ ફાયદા જાણવું છે જરૂરી



દરરોજ ચાલવા અને શારીરિક પ્રવૃત્તિ કરવાથી સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું જોખમ ઓછું થાય છે. ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે શારીરિક પ્રવૃત્તિથી સ્તન કેન્સરનું જોખમ ઓછું થાય છે. અમેરિકન કેન્સર સોસાયટી દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે મહિલાઓ અઠવાડિયામાં સાત કે તેથી વધુ કલાક ચાલે છે તેમને સ્તન કેન્સરનું જોખમ ૧૪% ઓછું હોય છે જેઓ અઠવાડિયામાં ૩ કલાક કે તેથી ઓછું ચાલે છે. તમારા દિવસની શરૂઆત ઝડપી ચાલવાથી કરતા તમે તાજગી અનુભવશો અને તમારી કાયાકલ્પ થઈ જશે. અભ્યાસમાં બહાર આવ્યું છે કે નિયમિત ચાલવું, તમારી ઉર્જાના સ્તરને વધારવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી શકે છે. તે થાક ઘટાડવામાં મદદ કરે છે, આખો દિવસ તમને ઉત્સાહિત રાખે છે. સવારે ચાલવુ તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ લાભ આપી શકે છે. તે એન્ઝાઈમ અને સેરોટોનિનને મુક્ત કરવામાં પણ મદદ કરે છે, જે તમારા શરીરના કુદરતી મૂડ અને કોન્ડિશન્સ વધારનારા છે. અધ્યયન સૂચવે છે કે નિયમિત ચાલવું એ ડિપ્રેશન અને અસ્વસ્થતાને મેનેજ કરવા અને અટકાવવાનો એક શ્રેષ્ઠ કુદરતી રીત હોઈ શકે છે. સક્રિય રહેવાથી મેલાટોનિનની અસરને વેગ મળે છે જે તમને સારી ઊંઘ આપે છે. મોર્નિંગ વોક એ માત્ર સુર્યોદય જોવાનો અથવા મિત્રોને મળવાનો શ્રેષ્ઠ રસ્તો નથી, પણ તે તમારી નિંદ્રાના ચક્રને સુધારે છે, સ્વસ્થ રાતની ઊંઘને પ્રોત્સાહન આપે છે. સારી રાતની ઊંઘનું પરિણામ તમને દિવસભર વધુ સચેત અને ઉત્સાહિત લાગે છે. વોકિંગમાં ઘણા બધા શારીરિક સ્વાસ્થ્ય લાભો છે, પરંતુ શું તમે જાણો છો, તમારા રોજિંદા શેડ્યૂલમાં મોર્નિંગ વોક કરવાથી તમારા મગજની કામગીરીમાં વધારો થાય છે. સંશોધનકારોને જાણવા મળ્યું છે કે ચાલવાથી મગજમાં લોહીનો પુરવઠો વધે છે જે સર્જનાત્મક કાર્ય, મેમરી અને સમસ્યાના નિરાકરણ સાથે જોડાયેલું છે.

તુલસીનો છોડ શિયાળામાં પણ હર્યોભર્યો રહેશે

અપનાવો આ ૫ દિપ્તિથી એક-એક પાન રહેશે લીલુછમ



મિત્રો શ્રી કૃષ્ણ ભગવાનની પ્રિય એવી તુલસી આપણા ઘરના આંગણા ની શોભા છે. તેથી આપણા હિન્દુ ધર્મમાં તુલસીના છોડ ની પૂજાપાઠ પણ કરવામાં આવે છે. એટલું જ નહીં ખાન પાનમાં પણ તે ખૂબ જ ઉપયોગી છે. ગળામાં દુખાવો હોય તો તુલસી વાળી કડક ચા પીવાનો સ્વાદ જ કંઈક અલગ હોય છે તેવી જ રીતે ઉકાળાની તો શાન છે તુલસી. સવાર અને સાંજના સમયે હવામાં થોડી ઠંડક અનુભવાઈ રહી છે. શિયાળાની અસર ઘરની બાલ્કનીમાં રાખેલા છોડ પર પણ દેખાવા લાગે છે. ઠંડી હવાના કારણે છોડના પાન ડ્રાય થઈને ખરવા લાગે છે. ખાસ કરીને રાતના સમયે છોડને નુકસાન થાય છે. મોટાભાગના લોકો પોતાની બાલ્કની, છત કે પછી ઘરના આંગણામાં તુલસીનો છોડ રાખે છે. જેને ઘરની અંદર રાખવો અશુભ માનવામાં આવે છે. અન્ય છોડ તો તમે ઘરની અંદર પણ રાખી શકો છો. પરંતુ શિયાળામાં તુલસીને બહાર રાખતી વખતે તે હર્યો-ભર્યો કેવી રીતે રહે તેના માટે આ ટિપ્સ ટ્રાય કરીને જોઈ શકો છો. જો તમે ઈચ્છતા હોવ કે તમારા ઘરમાં રહેલો તુલસીનો છોડ સૂકાય નહીં અને શિયાળામાં પણ વધતો રહે તો તમે કુંડામાં માટી સાથે રેતીનો પણ ઉપયોગ કરો. કુંડુ બહુ નાનું ન

હોય અને પાણી નીચેથી નીકળે તે માટે પૂરતી જઘા હોય. તેનાથી મૂળ ભીના ન રહે. શિયાળામાં મૂળ ભીના રહેવાથી છોડ ખરાબ થઈ શકે છે. ખાતર અને ઉપજાઉ માટી હોય તો તે બેસ્ટ છે. શિયાળાના દિવસોમાં દરરોજ કોઈપણ છોડમાં પાણી ન નાંખવું જોઈએ. તેનાથી છોડ ખરાબ થઈ શકે છે. તડકો, ખાતર, પાણી છોડ માટે ખૂબ જ જરૂરી તત્વ છે. તમે તુલસીના છોડને સુરક્ષિત રાખવા માગતા હોય તો તેમાં એક દિવસ છોડીને એક દિવસ એ રીતે પાણી આપો. ધ્યાન રાખો કે વધુ ઠંડુ પાણી પણ છોડમાં ન નાંખવું જઈએ. નળમાંથી આવતું ફેશ પાણી નાંખો કારણ કે, તેમાં થોડો ગરમાવો હોય છે. વચ્ચે-વચ્ચે સૂકા પાન, ડાળ, માંજર કાઢતા રહો. તેનાથી છોડનો ગ્રોથ પણ સારી રીતે થાય છે. જે જગ્યાએ તડકો આવતો હોય ત્યાં તુલસીના કુંડા મૂકો. શિયાળાના દિવસોમાં ઝાકળ પડવાના કારણે તુલસીના છોડને નુકસાન પહોંચી શકે છે. તેના માટે છત, આંગણામાં મુકેલી તુલસીને કોઈ સાફ લાલ રંગના સૂતરાઉ કાપડથી ઢાંકી દો. તમે ઈચ્છો તો શેડ પણ બનાવી શકો છો. જેથી છોડ પર ડાયરેક્ટ ઝાળક ન પડે. કોઈ શુભ દિવસ જોઈને પણ તુલસી પર લાલ ચુંદડી ચડાવી શકો છો. તુલસી એક પવિત્ર છોડ છે, તેથી તેમાં કૃત્રિમ ખાતર, યૂરિયા જેવી વસ્તુઓ નાંખવાનું ટાળવું જોઈએ. તમે તેમાં છાણથી બનેલું ખાતર, જૈવિક ખાતરનો ઉપયોગ કરી શકો છો. વચ્ચે-વચ્ચે માટી નાંખવાનું પણ જરૂરી છે. આનાથી છોડને ભરપૂર પોષણ મળતું રહેશે. જો તમને યોગ્ય જાણકારી ન હોય કે તુલસીના છોડમાં ક્યારે, કેટલું અને ક્યુ ખાતર નાંખવું જોઈએ તો તમે કોઈ છોડ વેચનાર કે ગાર્ડનિંગ એક્સપર્ટની સલાહ લઈ શકો છો. ઠંડીની સીઝનમાં ઈચ્છના હોવ કે તુલસીનો છોડ હર્યો-ભર્યો રહે તો તમે તેમાં લીમડાના પાનનું પાણી નાંખી શકો છો.



વારંવાર માથાનો દુખાવો? માથાનો દુખાવો એક-બે નહીં પરંતુ દરેક કારણોથી થાય છે. જો તમે પણ માથાના દુ:ખાવાથી પરેશાન છો તો આ ઘરેલું ઉપાય અપનાવો અને બિનજરૂરી દવાઓ લેવાનું ટાળો. માથાનો દુખાવો કોઈને પણ, ગમે ત્યાં થઈ શકે છે. આ એક એવી સમસ્યા છે જે બાળકોની સાથે સાથે વૃદ્ધોને પણ પરેશાન કરે છે. અન્ય યુવાનો મોટાભાગે તેની પકડમાં આવી જાય છે. આ એટલા માટે છે કારણ કે માથાનો દુખાવો કોઈ એક કારણથી થતો નથી, તેના ઘણા કારણો છે. ઉપરાંત, તે માત્ર શારીરિક કારણોસર જ નહીં પરંતુ માનસિક અને ભાવનાત્મક કારણોસર પણ છે. અહીં તે વિગતવાર સમજાવું. જો પેટમાં ગેસ બનવાને કારણે માથાનો દુખાવો થતો હોય તો તમે એક ગ્લાસ નવશેરું પાણી લો, તેમાં અડધું લીંબુ નીચોવી, બે ચપટી મરી નાખીને પીવો.



શુગરના દર્દીઓ માટે ગુડમારનું ઝાડ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં હાજર ફિનોલિક એસિડ નામનું તત્વ શુગરને કંટ્રોલ કરે છે.



કારેલા શુગરના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા પોષક તત્વો ફાયદાકારક હોય છે જે શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.



મેથીના દાણાનું સેવન શુગરનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે.

શું રાત્રે દહીં ખાવાથી ફાયદો થાય છે? રાત્રે દહીં ખાવાથી થઈ શકે છે આ સમસ્યાઓ



રાત્રે દહીં ખાવાની મનાઈ મોટાભાગના લોકો એટલા માટે કરે છે કે રેડી પ્રોડક્ટ ફેટ અને પ્રોટીનથી ભરપૂર હોય છે. તેવામાં રાત્રે આ પ્રકારની વસ્તુઓ ખાવાથી પાચનમાં સમસ્યા થાય છે. જો પાચન ખરાબ ન થાય તો અપથો, અનિદ્રા જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમને પણ પાચન સંબંધિત સમસ્યાઓ હોય તો તમારે રાત્રે દહીં ખાવું નહીં. આયુર્વેદ અનુસાર દહીંમાં ખાટા અને મીઠા બંને ગુણ હોય છે. તે શરીરમાં કફ કરી શકે છે. તેથી રાતના સમયે દહીં ખાવું જોઈએ નહીં. જો રાત્રે દહીં ખાવામાં આવે તો કફની સમસ્યા થઈ શકે છે. તેવામાં જે લોકોને ઉધરસ શરદી જેવી બીમારી હોય તેમણે દહીં ખાવાથી બચવું જોઈએ. કારણ કે રાત્રે દહીં ખાવાથી કેટલાક લોકોને સમસ્યાઓ થઈ શકે છે. દહીં એવી વસ્તુ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે કારણ કે તેની અંદર જે બેક્ટેરિયા હોય છે તે ઇમ્યુનિટી વધારે છે.

સ્પસ્થ રહેવું હોય તો આટલી કેલેરીવાળા ફળોનું સેવન કરો



કળીનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. તેમાં રહેલા પોષક તત્વો આપણને સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓથી તો દૂર રાખે છે, પરંતુ તેની પ્રાકૃતિક ખાંડ મીઠાઈની લાલસાને પણ પૂરી કરે છે. તમે તરબૂચ, ખાટાં ફળ, કેળા, સફરજન અને બેરી જેવા ફળો ખાઈ શકો છો. તેનો રસ કાઢવાને બદલે તેને કાપીને ખાવું વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજે અમે તમને નોની ફળના સ્વાસ્થ્ય લાભો રજૂ કરીએ છીએ જ્યાં હા, નોની એક એવું ફળ છે જે ઔષધિઓની યાદીમાં સમાવિષ્ટ છે, જેના પાંદડા, દાંડી, ફળ અને રસ તમામ દવા તરીકે વપરાય છે. એવું કહેવાય છે કે આ યમકારિક ફળ ૧૦૦ થી વધુ રોગોને દૂર કરવાની શક્તિ ધરાવે છે અને ૧૫૦ થી વધુ પોષક તત્વો મળી આવે છે. નોની ફળોના ઔષધીય ગુણધર્મોને કારણે, તેનો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિ વધારવા અને બિનઝેરીકરણ માટે પ્રાચીન સમયથી કરવામાં આવે છે.

BOLLYWOOD NEWS FLASH

સૈફ અલી ખાનનો રેકોર્ડ હજુ સુધી કોઈ અભિનેતા તોડી શક્યો નથી



! મુંબઈ, તા.૫ |

બોલિવૂડના દિગ્ગજ કલાકારોની યાદીમાં સૈફ અલી ખાનનું નામ હજુ પણ સામેલ છે. તેણે પોતાના જોરદાર અભિનયથી અત્યાર સુધી લોકોનું દિલ જીત્યું છે અને તે ૩૦ થી સતત ફિલ્મોમાં સક્રિય છે. હવે લોકોને OTT પર પણ સૈફનો જાદુ જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, સૈફના નામે હજુ પણ એક એવો રેકોર્ડ છે, જેને બોલિવૂડના ઘણા કલાકારો તોડી શક્યા નથી. બોક્સ ઓફિસ ઈન્ડિયાના ‘હિટ કાઉન્ટ એક્ટર ઓલ ટાઈમ’ વિશ્લેષ્ટમાં સૈફનું નામ ૭માં નંબર પર છે. તો ચાલો હવે તમને જણાવીએ કે બોક્સ ઓફિસ પર હિટ ફિલ્મો આપવાના મામલે કયા પ્રખ્યાત કલાકારો તેમની પાછળ છે. સૈફનું નામ આ વિશ્લેષ્ટમાં ૭મા નંબર પર છે. હવે તેના ખાતામાં કુલ ૧૨ પોઈન્ટ છે, જેમાં ૨ બ્લોકબસ્ટર, ૧ સુપરહિટ અને ૯ હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. રિતિકની વાત કરીએ તો તે આ વિશ્લેષ્ટમાં ૧૦માં નંબર પર છે. હા, આ બાબતમાં તે સૈફથી ઘણો નીચે છે.

ટ્રેડિશનલ સાઉથ ઈન્ડિયન લુકમાં ગોર્જિયસ લાગી હતી રોઝ



! મુંબઈ, તા.૫ |

હની રોઝે ૧૪ વર્ષની ઉંમરે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તમિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. બ્લોકબસ્ટર ફિલ્મો માટે ખાસ ઓળખ ધરાવતી આ અભિનેત્રીએ ૩૧ વર્ષની ઉંમરે ૬૩ વર્ષના હીરોની માતાનો રોલ કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ સુપરહિટ રહી હતી અને ૭૦ કરોડ રૂપિયાના બજેટવાળી ફિલ્મે અંદાજે ૧૩૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. દરેક પાત્રમાં કમાલ કરનાર અભિનેત્રી હની રોઝ રી સાઉથ સિનેમાનું જાણીતું નામ છે અને ટૂંક સમયમાં જ એક શાનદાર ફિલ્મમાં જોવા મળશે. આ પાન ઈન્ડિયા ફિલ્મનું નામ રશેલ છે. તે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થશે. હની રોઝ સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ સેલિબ્રિટીમાંથી એક છે. હની રોઝ પણ લેટેસ્ટ ટ્રેન્ડિંગ સ્ટાર છે. તેની તમામ નવી તસવીરો જેમ વાયરલ થાય છે હની રોઝ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ખબર અભિનેત્રીઓમાંની એક છે.

અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો લેઉ બિકિની લૂક વાયરલ



! મુંબઈ, તા.૫ |

પ્રિયંકા ચોપરા તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસ પોતાના ચાહકો માટે નવા લૂકમાં શાનદાર તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રી બિકિની લૂકમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. અભિનેત્રી પ્રિયંકા ચોપરાની બોલ્ડ બિકિની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. દરિયા કિનારે બિકિની લૂકમાં પ્રિયંકા ચોપરા ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળે છે. પ્રિયંકા ચોપરાનો બ્લેક બિકિનીમાં આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ તસવીર

દીપિકા અને આલિયા સિવાય નયનતારા સૌથી મોઢી અભિનેત્રી



! મુંબઈ, તા.૫ |

આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ સિવાય કંગના રનોત પણ એક એવી અભિનેત્રી છે જે પોતાના દમ પર ફિલ્મ ચલાવી શકે છે. આ ત્રણેય અભિનેત્રીઓની ફી ૧૦-૨૦ કરોડ રૂપિયાની વચ્ચે છે. પરંતુ આ ત્રણેયને ટક્કર આપનારી એક અન્ય અભિનેત્રી છે જે તેમના કરતા વધુ લોકપ્રિય છે. આ અભિનેત્રી બે જોડિયા બાળકોની માતા બની છે. તેના પતિ ફિલ્મ નિર્માતા છે. કોણ છે આ અભિનેત્રી? સૌથી પહેલા વાત કરીએ દીપિકા પાદુકોણની ફી વિશે. દીપિકા પાદુકોણ છેલ્લે પઠાણમાં જોવા મળી હતી. તેણે આ ફિલ્મ માટે ૧૫ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. તે જ સમયે, આલિયા ભટ્ટ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે એક રૂપિયામાં કામ કર્યું હતું. જ્યારે આ પછી આવેલી ફિલ્મ ‘ડાર્લિંગ’ માટે તેણે ૧૫ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. તે જ સમયે તેણે બ્રહ્માસ્ત્ર માટે ૧૨ કરોડ રૂપિયા લીધા હતા. બોલિવૂડ લાઈફના રિપોર્ટ અનુસાર, કંગના રનોતે ફિલ્મ ‘જજમેન્ટલ હે કયા’ માટે ૨૭ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. જોકે, તેણે ‘થાકડ’ માટે ૧૦ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. હવે વાત કરીએ એવી અભિનેત્રીઓની જે આ અભિનેત્રીઓ સાથે સ્પર્ધા કરે છે. તાજેતરમાં રિલીઝ થયેલી ‘જવાન’માં આ અભિનેત્રીએ શાહરૂખ ખાન સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ૭ સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી.

ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપ કુમાર મકવાણાએ વિશ્વ શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી



। પંકજ પંડિત ઝાલોદ, તા.૫ ।

સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ કાર્યરત છે જેમાં ધોરણ ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. સાથે સાથે અનાથ, અપંગ અને અતિગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન, તાલીમ અને જરૂરી મટીરીયલ આપવામાં આવે છે.

જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી - મોરા - સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણાએ તાલીમ વર્ગમાં તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને આજે વિશ્વ શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી હતી. દર વર્ષે પાંચ ઓક્ટોબરે વિશ્વ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ શિક્ષક દિવસનો ઉદ્દેશ્ય વિશ્વના શિક્ષકોની પ્રશંસા, મૂલ્યાંકન અને સુધારણા



પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે અને શિક્ષકો અને શિક્ષણ સંબંધિત મુદ્દાઓ પર વિચાર વિમર્શનો છે.વિશ્વમાંશિક્ષકો ક્યારે પણ સાધારણ નથી હોતા..અને વિદ્યાર્થીઓના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે . આમ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક શ્રી મકવાણા દિલીપકુમાર એચ. દ્વારા શુભેચ્છા પાઠવી હતી. સાથે સાથે ન્યુ પાર્થ મોરા તાલીમ કેન્દ્રના સંચાલક અશ્વિનભાઈ સી. સંગાડા, ન્યુ પાર્થ સુખસર તાલીમ કેન્દ્રના સંચાલક શ્રી રાજુભાઈ એસ. મકવાણા દ્વારા શિક્ષક દિનની શુભકામના પાઠવી હતી. ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી....

ખેલ મહાકુંભ ૨.૦ માં ચાર નવી રમતો આકર્ષણ ઊભું કરશે : ધારાસભા હોલ ખાતે મહત્વની બેઠક ચોખર્દ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને ખેલ મહાકુંભમાં બેડાવા પ્રોત્સાહન પૂરું પાડવા શિબિરો ચોખશે: જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી મમતા હીરપરા



। વડોદરા, તા.૫ ।

ખેલ મહાકુંભ ૨.૦ માટેના રજીસ્ટ્રેશન માટે વડોદરાની રમત ગમત કચેરીએ આગવી પહેલ કરી છે. જિલ્લામાંથી વધુમાં વધુ ખેલાડીઓ આ મહાકુંભમાં ભાગ લે તે હેતુથી ડી. ડી. ઓ. સુશ્રી મમતા હીરપરા, નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિની ઉપસ્થિતિમાં રમત-ગમતના શિક્ષકો તેમજ કોચ સાથે બેઠક યોજાઈ હતી.

આ વખતે ખેલ મહાકુંભ ૨.૦ માં તાલુકા કક્ષાએ વિજેતા થનાર માટે સમાન રોકડ પુરસ્કાર, દરેક વય જૂથ માટે સમાન રોકડ પુરસ્કાર તેમજ ખેલાડીઓ માટે આ વખતે ચાર નવી રમતો વુડબોલ, બીચ વોલીબોલ, બીચ હેન્ડબોલ અને સેપક ટકરા જેવી રમતો આકર્ષણ ઊભું કરશે. ખેલ મહાકુંભ ૨.૦ ના દરેક પ્રોફેશનલ સ્પોર્ટ્સ લીગના વિજેતા ખેલાડીઓ તેમજ દિવ્યાંગ ખેલાડીઓ માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી મમતા હિરપરાએ વિવિધ રમતોમાં મહત્તમ ભાગીદારી કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ખેલાડીઓ તેમની રમત ગમત પ્રત્યેની કુશળતાનું શ્રેષ્ઠ પ્રદર્શન

કરે તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કરવાની આશા વ્યક્ત કરતાંની સાથે તેણીએ કહ્યું હતું કે, રમત-ગમત એ સ્વસ્થ સમાજનો મહત્વપૂર્ણ ભાગ છે. દરેક ખેલાડીએ આ આવેલા અવસરને વધાવીને અચૂક ભાગ લેવો જોઈએ તેમ કહેતાં સમગ્ર જિલ્લાની શાળાઓ અને કોલેજોમાં ખેલ મહાકુંભ વિશે જાગૃતિ લાવવા શિબિરોનું આયોજન કરવાનું સૂચન કર્યું હતું. તેમજ ખેલ મહાકુંભમાં મહત્તમ ખેલાડીઓ ભાગ લે તે માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતાં.

જિલ્લા રમત-ગમત વિકાસ અધિકારી કિષ્ના પંડ્યા અને જિલ્લા રમત-ગમત અધિકારી દિનેશ કદમે ખેલ મહાકુંભ ૨.૦ માં સમાવિષ્ટ નવી બાબતો અને રમતો વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. જેમાં તાલુકા કક્ષાના ખેલાડીઓ માટે ઈનામની રકમ, એક ખેલાડી બે રમતોમાં ભાગ લઈ શકે છે અને ઓનલાઈન ફરજિયાત રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જેવા કેટલાક મહત્વના મુદ્દાઓનો ઉલ્લેખ તેઓએ મીટીંગ દરમિયાન કર્યો હતો.

ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત

લીમડી પી.એસ આઇ એમ.એફ.ડામોર દ્વારા ટાંડી મુકામે મીટિંગ કરી ગામની સમસ્યાનો નિકાલ કરવા પ્રયત્ન કરાયો



। ઝાલોદ, તા.૫ ।

ગુજરાત રાજ્યના ડી.જી.પી ની સૂચના મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં તથા આઉટ પોસ્ટ વિસ્તારમાં “ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી” સૂત્ર હેઠળ ગ્રામજનોના ત્રણ પ્રાણ પ્રશ્નો તથા પોલીસ તરફથી ત્રણ વાત એમ

મિટિંગમાં ચર્ચા કરી ગામની સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવવા પ્રયાસ કરવા પોલીસ સ્ટેશન લેવલે લીમડી પોલીસ સ્ટેશનમાં તેમજ આઉટ પોસ્ટ લેવલે નાની હાંડી ગામમાં મીટીંગ યોજી પી.એસ. આઈ એમ.એફ.ડામોર દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી.

આઝાદભારતી બાળ સંસ્કાર કેન્દ્ર પીછોડામાં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી



। ઝાલોદ, તા.૫ ।

સંજેલી તાલુકાના પીછોડામાં શ્રી રાષ્ટ્રભક્તિ જન સેવા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઝાદ ભારતી બાળ કેન્દ્ર કાર્યરત છે. આ બાળ કેન્દ્રમાં પીછોડાના કેયુરભાઈ ની જન્મ દિવસની આજરોજ ઉજવણી કરવામાં

આવી. જેમાં લીમખેડા ઘટક -૨ ના Pse ઈન્સ્ટટર શ્રીમતી મીનાક્ષીબેન હાજર રહીને કેયુર કુમારને કુમ કુમ તિલક કરી નોટબુક, બોલપેન, આપી તેમજ ચોકલેટ ખવડાવીને ઉજવણી કરવામાં આવી. તમામ બાળકોને ચોકલેટો આપી અને અભિનંદન આપવામાં આવ્યા.

ઝાલોદ તાલુકાના સેવાભાવી સામાજિક કાર્યકર્તાઓ રક્તદાન કરી સમાજ માટે આદર્શ બન્યા

। ઝાલોદ, તા.૫ ।

જે અન્નદાતા કરે છે તે અન્નદાતા કહેવાય છે, જે વિધાદાન કરે છે તે જ્ઞાનદાતા કહેવાય છે, ધનધાન કરનારા ધનદાતા કહેવાય છે પણ જે રક્તદાન કરે છે તે તો જીવનદાતા કહેવાય છે. ઝાલોદ ના રાષ્ટ્રપ્રેમી સેવાભાવી યુવાનોમાં એક નામ એટલે જ શ્રી સંતોષભાઈ ભગોરા દર વખતની જેમ જરુરિયાતમંદ દર્દીનું દર્દ સમજી જનસમાજની સાચી સેવામાં પોતાનું યોગદાન આપી સાચી સમાજસેવા કરવા આજરોજ બાજરવાડા ગામની બે ટકા રક્ત



ધરાવતી બહેનના આરોગ્યની ચિંતા કરી તેમની તબિયત જલ્દી સારી થાય તે માટે રક્તદાન કરી પોતાના જીવનને ધન્યતા સમજી એવા ભાજપ યુવામોર્યા ઝાલોદ નગર પ્રમુખ સંતોષભાઈ ભગોરાને રક્તદાન લેનાર પરિજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.

બોટાદના સરવર્ધ ગામની શાળાના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ સંપન્ન : વન્ય પ્રાણીઓની ઓળખ, પ્રકૃતિના સંવર્ધન સહિતના મુદ્દાઓને આવરીને બાળકોને માર્ગદર્શિત કરાયા

। બોટાદ, તા.૫ ।

રાજ્યમાં તારીખ ૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન ૩૩ જિલ્લા અને ૨૫૦ તાલુકાઓમાં ‘વન્ય પ્રાણી સમાહ’ની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે બોટાદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. બોટાદ જિલ્લા

નાયબ વન સંરક્ષકશ્રી આયુષ વર્માના માર્ગદર્શન હેઠળ બોટાદ રેન્જ દ્વારા સરવર્ધ ગામની શાળાના બાળકો માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને વન્ય પ્રાણીઓનું મહત્વ, વન્ય પ્રાણીઓની ઓળખ સહિતના મુદ્દાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

ભિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી સંચાલિત સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા વન્ય જીવ સપ્તાહની ઉજવણી કરાઈ



। દીપક જગતાપ રાજપીપળા, તા.૫ ।

નર્મદા જિલ્લામાં કુદરતી વન સંપદા અખૂટ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર છે. ત્યારે જિલ્લામાં તા. ૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન વન્ય પ્રાણી સમાહની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રાણીસૃષ્ટિના રક્ષણ અને સંરક્ષણને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે થઈ રહેલી વન્ય પ્રાણી સમાહની ઉજવણીના ભાગરૂપે ભિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી - રાજપીપળા સંચાલિત સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા તા. ૩ જી ઓક્ટોબર, ૨૦૨૩ ને મંગળવારના રોજ વન્ય જીવ સમાહની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે વન્યજીવ આધારિત ક્વિઝ, રંગોળી, કોલાજ આર્ટ, વક્તૃત્વ, વન્યજીવ પર ફોટોગ્રાફી અને પોસ્ટર સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મધુકર પાડવીએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો

હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજપીપળા વન વિભાગના અધિકારી જિગ્નેશભાઈ સોનીએ તેમની ટીમ સાથે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને વનવિભાગની કામગીરીમાં વપરાતા અત્યાધુનિક સાધનો જેવા કે ટ્રેકિંગ ડીવાઈઝ, જંગલ ખાતાની કામગીરી, વન વિભાગમાં કેરિયર અને પોતાના રેસ્ક્યુ ઓપરેશનોની રસપ્રદ માહિતી આપી હતી. જ્યારે વિષય તજજ્ઞ તરીકે મહેસાણા સ્થિત મ્યુનિસિપલ આર્ટસ અને અર્બન બેંક સાયન્સ કોલેજના પ્રાણીશાસ્ત્ર વિભાગના અધ્યાપક ડૉ. જિગ્નેશ કનેજીયા અને સરકારી વિજ્ઞાન કોલેજ- વડનગરના પ્રાધ્યાપક શ્રીકાંત મકવાણાએ વન્ય જીવોને કેન્દ્રમાં રાખીને પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. આ અવસરે સ્કૂલ ઓફ આર્ટસ, કોમર્સ અને સાયન્સના કેમ્પસ કો-ઓર્ડીનેટર ડૉ. પ્રકાશચંદ્ર જોષી, સ્કૂલ ઓફ કોમર્સના કો-ઓર્ડીનેટર પ્રા. રાજેશભાઈ ઝાલા તથા સ્ટાફ મિત્રો અને બિન શૈક્ષણિક સ્ટાફ હાજર રહી ઉજવણીને સફળ બનાવી હતી.

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં રણોલી ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરી

। આણંદ, તા.૫ ।

રાજ્ય વન વિભાગ દ્વારા દર વર્ષે રજી થી ૮મી ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સમાહની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગ રૂપે તા.૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન આણંદ જિલ્લામાં વન્ય પ્રાણી સમાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં બોરસદ તાલુકાના રણોલી સ્થિત રણોલી હાઈસ્કૂલ ખાતે આણંદ જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ, આણંદ દ્વારા વન્યજીવોના અસ્તિત્વ, વન્યજીવોના મહત્વ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા કક્ષાના વન્યપ્રાણી સમાહની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે વન્ય પ્રાણી સમાહની ઉજવણીનો મુખ્ય હેતુ વન્યજીવોના અસ્તિત્વને ટકાવી રાખવા માટે તેમના સંરક્ષણના કાર્યને પ્રાધાન્ય મળે તે માટેનો છે. શ્રી રમણભાઈએ કહ્યું હતું કે વન્યજીવો પર્્યાવરણના સંતુલનને જાળવી રાખવામાં અતિ મહત્વનો ભાગ ભજવે છે જ્યારે વન વિભાગ એ વન્યજીવોના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સતત કાર્યરત રહે છે. નાયબ મુખ્ય દંડકશ્રી એ પાણી અને વિજળીનો સમજદારીભર્યા ઉપયોગ અને વાહનોનો



બંને એટલો ઓછો ઉપયોગ કરી હવાના પ્રદુષણને ઘટાડવા પર્્યાવરણને સંતુલિત રાખવા તથા વન્ય પ્રાણીઓના સંરક્ષણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. જિલ્લાની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા બાળકોને સાંપ, મગર અને સારસ સહિતના વન્ય પ્રાણીઓના જીવન, અસ્તિત્વ, સામાન્ય આદતો, મહત્વ અને સંરક્ષણ વિશે વિગતવાત જાણકારી આપવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે શાળામાં મહાનુભાવો હસ્તે વૃક્ષારોપણ કરવામાં આયુ હતું. અંતમાં શાળાના આચાર્યશ્રી આશિષભાઈ શાહ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષકશ્રી નમ્રતાબેન ઈટાલિયન, બોરસદના પ્રાંત અધિકારીશ્રી જય બારોટ, વન વિભાગના અધિકારી-કર્મચારીઓ, રણોલી કેળવણી મંડળના પ્રમુખ અને સભ્યશ્રીઓ, અગ્રણી સર્વશ્રી ધરમદેવ સિંહ ડાભી, મફતભાઈ અને શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં.

આજનું રાશિ ભવિષ્ય.....



મેષ (અ,લ,ઇ) :

આજના દિવસે વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે. પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટે ની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય. જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે. તમારા મિત્ર સાથે બહાર જાવ ત્યારે સારી રીતે વર્તો.



સિંહ (મ,ટ) :

આજના દિવસે તમારો જીદી અભિગમ તમારા ખુશખુશાલ જીવન માટે ત્યજી દો, કેમ કે આ બાબત સમયનો નર્ચો વેડફાટ છે. જો તમે છાત્ર છો અને વિદેશ માં જયી ને ભણતર કરવા માંગતા હોવ તો ઘરની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે. પારિવારિક મોરચો ખુશખુશાલ તથા સરળ નથી લાગતો. દરેક વસ્તુ પર પ્રેમ બતાવવો તે યોગ્ય નથી.



ધન (ભ,ધ,ફ) :

આજના દિવસે સફળતા હાથવેંતમાં હોવા છતાં શક્તિનો ક્ષય થતો લાગશે. જે લોકોએ પોતાના પૈસા જુગારમાં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે. તમને જુગાર થી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. પારિવારિક મોરચે સ્વસ્થતા જણાય છે અને તમારી યોજનાઓમાં તેમના સંપૂર્ણ સહકારની અપેક્ષા રાખી શકો છો.



વૃષભ (બ,વ,ઉ) :

આજના દિવસે તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો- આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે. મગજએ તમારા જીવનનું પ્રવેશદાર છે કેમ કે સારું-ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે. તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે.



કન્થા (પ,ઠ,ણ) :

આજના દિવસે આજે તમે જે કેટલાક ભોતિક ફેરફારો કરશો તે ચોક્કસ જ તમારા દેખાવનો ઓર નીખારશે. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. તમને એકલવાયું લાગે ત્યારે તમારા પરિવારની મદદ લો. એ તમને હતાશાથી બચાવશે. વળી, એ તમને સમજદારીભર્યા નિર્ણયો લેવામાં પણ મદદ કરશે.



મકર (મ,જ) :

આજના દિવસે આજે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશે-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. ગત દિવસો માં જેટલું ધન તમે પોતાના આજ ને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનું ફાયદો તમને આજે મળી શકે છે. પૈતૃક સંપત્તિમાં વારસાના સમાચાર તમારા આખા પરિવારને ખુશખુશાલ કરી મુકશે.



મિથુન (ક,ઇ,ઘ) :

આજના દિવસે હળવા થવા માટે નિકટના મિત્રો સાથે સમય વિતાવજો. તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકર્ષક સાબિત થશે. મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મુકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે. તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી-હાસ્યનો કોઈ અવાજ નથી-હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો.



તુલા (ર,ત) :

આજના દિવસે તમારા અધીરો તથા જિદી સ્વભાવ પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો ખાસ કરીને પાર્ટીમાં કેમ કે ત્યાં આ સ્વભાવ મૂડ બગાડી શકે છે. જે લોકોએ ભૂતકાળ માં પોતાનું ધન નિવેશ કર્યું હતું તે લોકો ને તે ધન થી લાભ થવાની શક્યતા છે. આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે-પણ ધ્યાન રાખજો કેમ કે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે.



કુંભ (ગ,શ,સ) :

આજના દિવસે તમારા સ્વાસ્થ્ય ખાતર બૂમાબૂમ કરશો નહીં. આજે કોઈ લેણદાર તમારા ઘરે આવી શકે છે અને તે તમારા થી પૈસા ઉધાર માંગી શકે છે. તેને પૈસા આપી તમે આર્થિક તંગી માં આવી શકો છો. તમને સલાહ આપવા માં આવે છે કે ઉધાર લેવા થી બચો. તમારા ઘરના વાતાવરણમાં તમે અનુકુળ ફેરફાર કરશો. તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં દંઢેરો પીટતા નહીં.



કર્ક (ડ,ઢ) :

આજના દિવસે આજે તમારામાં ઊર્જાની વિપુલતા હશે-પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે. જે લોકો ની અત્યાર સુધી પગાર નથી આવી તે લોકો પૈસા માટે પરેશાન રહી શકે છે અને પોતાના મિત્રો થી ઉધાર માંગી શકે છે. તમારી જીભ પર કાબૂ રાખો કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુભાઈ શકે છે. બકવાસ કરીને સમય વેડફવા કરતાં શાંત રહેવું વધુ સારું છે.



વૃશ્ચિક (ન,ય) :

આજના દિવસે સાંજે થોડીક હળવાશ માણો. આજે કોઈ લેણદાર તમારા ઘરે આવી શકે છે અને તે તમારા થી પૈસા ઉધાર માંગી શકે છે. તેને પૈસા આપી તેને આર્થિક તંગી માં આવી શકો છો. તમને સલાહ આપવા માં આવે છે કે ઉધાર લેવા થી બચો. ઘર ના કોઈપણ સભ્ય ના વર્તન ને કારણે તમે પરેશાન થઈ શકો છો. તમારે તેમની સાથે વાત કરવા ની જરૂર છે.



મીન (દ,ચ,ઝ,થ) :

આજના દિવસે તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે. મનોરંજન અથવા કોસ્મેટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. તમારા પરિવારના સભ્યોની જરૂરીયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથમિકતા હોવી જોઈએ. પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે.

ન્યૂઝ ફિક્સ

મેક્સિકોની સંસદમાં ૧૦૦૦

વર્ષ જૂની એલિયનની બોડી

પ્રદર્શિત કરવામાં આવી હતી

| નવી દિલ્હી, તા.૫ |

૨૦૦૩ માં, દક્ષિણ અમેરિકાના ચિલીમાં એક મમીફાઈડ એલિયન મળી આવ્યું હતું. તેનું નામ 'આતા' રાખવામાં આવ્યું હતું. આ ૬ ઈંચનું હાડપિંજર પૃથ્વી ગ્રહનું હોવાનું દેખાતું ન હતું, કારણ કે, તેની પાસે માનવ જેવી ખોપરી નથી અને તેની પાસે ૧૨ ને બદલે માત્ર ૧૦ પાંસળી હતી. આવું લક્ષણ મનુષ્યોમાં ક્યારેય જોવા મળ્યું ન હતું. જોકે, બાદમાં ડીએનએ પરીક્ષણમાં જાણવા મળ્યું કે, આ અવશેષો એક મહિલાના છે, જેનું ૪૫ વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. ૨૦૧૧માં એક રશિયન મહિલાએ દાવો કર્યો હતો કે, તેના ફિજમાં એલિયનનો મુતદેહ છે. મહિલાએ કહ્યું કે, તેણે ૨૦૦૮માં તેના ઘરની નજીક થયેલા UFO કેશના સ્થળેથી એક વિચિત્ર વસ્તુ મેળવી હતી અને તેને ૨ વર્ષ સુધી બરફમાં રાખ્યો હતો.

રાણીની સમાધિમાંથી સીલબંધ

દારૂની મળી બરછી

| નવી દિલ્હી, તા.૫ |

ઈજિપ્ત, જર્મની અને ઓસ્ટ્રિયાની પુરાતત્વીય ટીમે એક નવી શોધ કરી છે. તેઓએ કબરમાંથી સીલબંધ બરછીમાં લગભગ ૫૦૦૦ વર્ષ જૂની વાઈન બહાર કાઢી છે. આ વાઈનની બરછીઓ ક્યારેય ખોલવામાં આવી ન હતી. આ શોધ એબીડોસ, સોહાગમાં રાણી મર્નિથની કબરમાં કરવામાં આવી હતી. પ્રાચીન વાઈન ઉપરાંત, ટીમને અહીં ઘણું ફર્નિચર પણ મળ્યું, જેનો ઉપયોગ અંતિમ સંસ્કાર માટે કરવામાં આવતો હતો. આ શોધથી ટીમને પ્રાચીન રાણીના જીવન અને તેના શાસનના સમય વિશે વધુ માહિતી મળી. ટીમને એક હસ્તપ્રત પણ મળી હતી, જે દર્શાવે છે કે, તેણી સરકારી કચેરીઓનો હવાલો સંભાળતી હતી. કબર પરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, તે કાચી ઈંટો, માટી અને લાકડાના પાટિયા જેવી સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી.



ભૂદંભુભઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ (BEST) મુજબ, છેલ્લી ડબલ ડેકર બસ તેની ૧૫ વર્ષની કોડલ લાઈફ પૂર્ણ થવાને કારણે તબક્કાવાર બંધ કરવામાં આવશે. એક મહિના કરતાં પણ ઓછા સમય પહેલાં બેસ્ટની છેલ્લી ડીઝલથી ચાલતી, ડબલ ડેકર બસ ઇતિહાસ બની ગઈ હતી.



બ્રિટનમાં ઈમિગ્રન્ટ્સ વિરોધી માહોલ ભારતીય મૂળના મંત્રીએ કહ્યું માઈગ્રેશન અટકાવો

| નવી દિલ્હી, તા.૫ |

બ્રિટનમાં ભારતીય મૂળના વડાપ્રધાન રિશિ સુનકે બહારથી મોટી સંખ્યામાં આવી રહેલા માઈગ્રન્ટ્સ વિરોધી વલણ અપનાવ્યું છે. તેમની સરકારના ભારતીય મૂળના મંત્રી પણ ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ છે અને સંસદમાં કહ્યું છે કે બહારના લોકોને નિયંત્રણ વગર આવવા દેવાશે તો બ્રિટનમાં ઈમિગ્રન્ટ્સનું વાવાઝોડું આવશે. બ્રિટનના ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને જણાવ્યું કે બ્રિટને યોગ્ય નિયંત્રણો મુકવા જ પડશે નહીંતર બહારથી મોટી સંખ્યામાં લોકો અહીં આવી જશે. ત્યાર પછી તેમને કન્ટ્રોલ કરવાનું મુશ્કેલ બની જશે. મંગળવારે બ્રેવરમેને અનઓથોરાઈઝડ માઈગ્રન્ટ્સ, હુમન રાઈટ્સના કાયદા અને તેમની નીતિઓના ટીકાકારોની ઝાટકણી કાઢી હતી. બ્રેવરમેનના માતા અને પિતા બંને ભારતીય મૂળના છે જેઓ ૧૯૬૦ના દાયકામાં યુકે આવ્યા હતા. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે અને વ્યવસાયે વકીલ રહી ચુક્યા છે. તેઓ ઈમિગ્રન્ટ્સ પર અત્યંત કડક નિયંત્રણો લાદવાની ફેવર કરે છે. તેમણે માનવ અધિકારના રક્ષણના નામે માઈગ્રન્ટનો બયાવ કરનારાઓની પણ ટીકા કરી છે.

આ ઉપરાંત ઉદારવાદી સામાજિક વેલ્યૂના ટીકાકાર છે. તેમણે એવું પણ કહી દીધું કે હુમન રાઈટ્સ એક્ટ એ હકીકતમાં કિમિનલ રાઈટ્સ એક્ટ છે. આ ઉપરાંત તેઓ ટ્રાન્સવીમનને મહિલાઓની હોસ્પિટલના વોર્ડ માટે એલાઉન્સ આપવાના વિરોધી છે. બ્રેવરમેને સ્પષ્ટ કહ્યું છે કે તેઓ જેન્ડરની વૈચારિક માન્યતાના વિરોધી છે અને

બ્રિટનની શૈક્ષણિક તથા સાંસ્કૃતિક સંસ્થાઓમાંથી બ્રિટિશ વિરોધી હિસ્ટ્રીને દૂર કરવા માંગે છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી બ્રિટિશ સરકારે ઈમિગ્રન્ટ્સ પ્રત્યે નરમ વલણ અપનાવતી હતી કારણ કે તેને પોતાને વંશવાદી કહેવામાં આવે તેની બીક હતી. તેમણે એમ પણ કહ્યું કે તેમનો કન્ઝર્વેટિવ પક્ષ દેશની સરહદોને મજબૂત બનાવશે અને ગેરકાયદે લોકોને અંદર ઘુસવા નહીં દે. બ્રેવરમેને કહ્યું કે બહારના લોકો માટે બ્રિટનમાં શરણ મેળવવાનું કામ સરળ હોતું ન જોઈએ.

શરણાર્થીઓ સામે આકરા પગલાં લેવા બદ તેમણે સરકારના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે બ્રિટનની સંસદમાં તાજેતરમાં પસાર કરવામાં આવેલા કાયદાનો ઉલ્લેખ પણ કર્યો હતો જે હજુ અમલમાં નથી આવ્યો. આ કાયદા પ્રમાણે ઈંગ્લિશ ચેનલ પાર કરીને બ્રિટનમાં ઘુસી આવેલા ગેરકાયદે લોકોને ડિટેઈન કરવામાં આવશે તથા તેમનું કાયમ માટે ડિપોર્ટેશન કરવામાં આવશે. આ લોકોને તેમના પોતાના દેશમાં અથવા કોઈ પણ ત્રીજા દેશમાં મોકલી દેવામાં આવશે. બ્રિટન આ રીતે ગેરકાયદે લોકોને પકડીને રવાન્ડા મોકલી દેવાની યોજના ધરાવે છે અને આ માટે રવાન્ડા સાથે એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે.

બીજા કોઈ દેશે આવા કરાર કરવા માટે તૈયારી દર્શાવી નથી. બ્રિટનમાં ૨૦૨૪માં ચૂંટણી આવવાની છે જેમાં વડાપ્રધાન રિશિ સુનક માટે આકરા ચઢાણ રહેવાની શક્યતા છે. હાલના ઓપિનિયન પોલ મુજબ લેબર પાર્ટી કરતા સુનકનો પક્ષ પાછળ ચાલે છે.



મુંબઈ પોલીસે ગુરુવારે આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકરો અને સમર્થકોની અટકાયત કરી હતી, જેઓ પાર્ટીના સાંસદ સંજય સિંહની ધરપકડનો વિરોધ કરી રહ્યા હતા. ભુધવારે સંજય સિંહની ધરપકડ થયા બાદ આમ આદમી પાર્ટી ભારતના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. AAP કાર્યકર્તાઓએ રાષ્ટ્રીય રાજધાનીમાં આમ આદમી પાર્ટીના કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કર્યું.

વિશેષ જો પ્રાકૃતિક ખેતી નહીં અપનાવીએ તો આપણે આપણા બાળકોને વારસામાં રેતી આપીને જઈશું : ટી. વિજયકુમાર

ગુજરાત પ્રાકૃતિક ખેતીનું 'મોડેલ' બને એવા પ્રયત્નો ફરીએ : આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને પ્રાકૃતિક ખેતીના પરિણામોની સમીક્ષા કરવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે રાજભવનમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર અને આંધ્રપ્રદેશના કૃષિ વિભાગના કિસાન સશક્તિકરણ સંગઠનના એક્ઝિક્યુટિવ ઉપાધ્યક્ષ શ્રી ટી. વિજયકુમારની ઉપસ્થિતિમાં વિસ્તૃત વિચાર-વિમર્શ કરાયો હતો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભૂમિ, પાણી, પર્યાવરણ કે સ્વાસ્થ્ય; તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક ખેતી છે. પ્રાકૃતિક ખેતી સંપૂર્ણપણે વૈજ્ઞાનિક ખેતી છે. પ્રાકૃતિક ખેતી સિવાય વિશ્વ પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ગુજરાત દુનિયા માટે પ્રાકૃતિક ખેતીનું 'મોડેલ' બને એવા પ્રયત્નો કરીએ.

પ્રત્યેક ગામમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીનું મોડેલ ફાર્મ બનાવે જેથી અન્ય ખેડૂતોને પ્રેરણા મળે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વૈજ્ઞાનિકો સંશોધનો કરે અને પ્રાકૃતિક કૃષિનું વિજ્ઞાન લોકો સમક્ષ મૂકે જેથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની સફળતા સંદર્ભે કોઈ સંદેહ ન રહે. પ્રાકૃતિક કૃષિ માટે માનસિકતા બદલવાની આવશ્યકતા છે. યોગ્ય પદ્ધતિસર પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો પહેલા જ વર્ષથી યોગ્ય ઉત્પાદન મળતું થઈ જાય છે, એટલું જ નહીં



ભૂમિની ગુણવત્તા સુધરવા મંડે છે. તમામ પ્રકારે લાભદાયી એવી પ્રાકૃતિક ખેતી વર્તમાન સમયની અનિવાર્યતા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પ્રયત્નશીલ છે ત્યારે સૌના સહયોગ સક્રિય પ્રયત્નોની આવશ્યકતા છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે,

પ્રાકૃતિક ખેતીથી ફાયદાઓ જ ફાયદા છે. સંશોધન અને શિક્ષણનું કામ કરતી કૃષિ યુનિવર્સિટીઓ પ્રાકૃતિક ખેતીમાં સંશોધનો કરે અને એ સંશોધનો ખેડૂતો સુધી પહોંચાડે જેથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવામાં ખેડૂતના મનમાં કોઈ શંકા ન રહે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માનવતાના કલ્યાણ માટે, ભારત દેશના હિતમાં પ્રાકૃતિક ખેતીને

'મિશન' બનાવ્યું છે ત્યારે, સૌએ આ 'મિશન'ને સફળ બનાવવામાં પુરા મનથી જોડાઈ જવાની જરૂર છે. તેમને પરિણામલક્ષી કામગીરીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

મુખ્ય સચિવ શ્રી રાજકુમારે કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ માટે મિશન મોડ પર કામ કરવું પડશે. આ માટે આયોજનબદ્ધ રીતે આગળ વધવું પડશે. સ્વ-સહાય જૂથોની મહિલાઓની મદદથી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ

વધુ ઝડપથી વધારી શકાશે. સાથોસાથ પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના પ્રમાણન અને વેચાણની વ્યવસ્થાઓ પણ સુદૃઢ કરાશે. ગુજરાતના કૃષિ વૈજ્ઞાનિકો સંશોધનો કરીને પ્રાકૃતિક કૃષિના પરિણામો-અભ્યાસો લોકો સમક્ષ મૂકશે તો પ્રાકૃતિક ખેતી માત્ર પરંપરાગત જ્ઞાન અને અનુભવ આધારિત ખેતી નથી પણ એક વિજ્ઞાન છે; તે ખેડૂતોને સમજાશે તો તેઓ સરળતાથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવશે.



